



کتاب خانہ

خاموش شاہزادہ

Khamosh Shahzada (Gujarati)



اگر مہینہ بگا رہے گا
اِنْ شَاءَ اللّٰهُ عَزَّوَجَلَّ



- کتاب کو پڑھنے کے بعد بھرپور توجہ سے پڑھنا
- اس میں لکھے ہوئے تمام باتوں کو عمل میں لانا
- منہ سے جملے اور کلمات نکالنا
- خاموشی کی باتوں سے بچنا
- اس میں لکھے ہوئے تمام باتوں کو عمل میں لانا
- اس میں لکھے ہوئے تمام باتوں کو عمل میں لانا
- اس میں لکھے ہوئے تمام باتوں کو عمل میں لانا

یہ کتاب تیسری بار شائع ہوئی ہے۔ اس میں نئے نئے بابوں کی مدد سے اس کتاب کو مزید دلچسپ اور مفید بنایا گیا ہے۔

مؤلف: مولانا محمد امجد علی صاحب مدظلہ العالی

مکتبۃ المدینہ
(دہلی)

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ
أَمَّا بَعْدُ فَأَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ. الْحَمْدُ لِلَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ.

કિતાબ પઢને કી દુઆ

અઝ : શૈખે તરીકત, અમીરે અહલે સુન્નત, બાનિયે દા'વતે ઈસ્લામી, હઝરત અલ્લામા

મૌલાના અબૂ બિલાલ મુહમ્મદ ઈલ્યાસ અત્તાર કાદિરી ર-ઝવી دَامَتْ بَرَكَاتُهُمُ الْعَالِيَةِ ૨-ઝવી

દીની કિતાબ યા ઈસ્લામી સબક પઢને સે પહલે જૈલ મેં દી હુઈ દુઆ પઢ

લીજિયે إِنَّ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ જો કુછ પઢેંગે યાદ રહેગા. દુઆ યેહ હૈ :

اللَّهُمَّ افْتَحْ عَلَيْنَا حِكْمَتَكَ وَأَنْشُرْ
عَلَيْنَا رَحْمَتَكَ يَا ذَا الْجَلَالِ وَالْإِكْرَامِ

તરજમા : એ અલ્લાહ! عَزَّوَجَلَّ હમ પર ઈલ્મ વ હિક્મત કે દરવાજે ખોલ દે ઔર હમ પર અપની

રહમત નાઝિલ ફરમા ! એ અ-ઝમત ઔર બુઝુર્ગી વાલે ! (المُسْتَرْفِجُ ص 10، دارالفکر بیروت)

નોટ : અવ્વલ આખિર એક એક બાર દુરુદ શરીફ પઢ લીજિયે.

તાલિબે ગમે મદીના

વ બકીઅ

વ મસ્જિદત

13 શવ્વાલુલ મુકર્રમ 1428 હિ.



“ખામોશ શહાદા”

યેહ રિસાલા (ખામોશ શહાદા)

શૈખે તરીકત, અમીરે અહલે સુન્નત, બાનિયે દા'વતે ઈસ્લામી હઝરત અલ્લામા

મૌલાના અબૂ બિલાલ મુહમ્મદ ઈલ્યાસ અત્તાર કાદિરી ર-ઝવી دَامَتْ بَرَكَاتُهُمُ الْعَالِيَةِ ૨-ઝવી

ને ઉર્દૂ ઝબાન મેં તહરીર ફરમાયા હૈ.

મજલિસે તરાજિમ (દા'વતે ઈસ્લામી) ને ઈસ રિસાલે કો ગુજરાતી રસ્મુલ

ખત મેં તરતીબ દે કર પેશ કિયા હૈ ઔર મક-ત-બતુલ મદીના સે શાએઅ કરવાયા

હૈ. ઈસ મેં અગર કિસી જગહ કમી બેશી પાએ તો મજલિસે તરાજિમ કો (બ ઝરીઅએ

મક્તૂબ, ઈ-મેઈલ યા SMS) મુત્તલઅ ફરમા કર સવાબ કમાઈયે.

રાબિતા : મજલિસે તરાજિમ (દા'વતે ઈસ્લામી)

મક-ત-બતુલ મદીના

સિલેક્ટેડ હાઉસ, અલિફ કી મસ્જિદ કે સામને, તીન દરવાઝા,

અહમદઆબાદ-1, ગુજરાત, ઈન્ડિયા

MO. 9374031409 E-mail : tarajimhind@gmail.com

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ
 آمَّا بَعْدُ فَأَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

ખામોશ શહજાદા¹

શૈતાન લાખ રોકે મગર યેહ રિસાલા (48 સફહાત)

મુકમ્મલ પઠ લીજિયે અગર ઝબાન કી એહતિયાત કી આદત ન
 હુઈ તો દિલ ખૌફે ખુદા સે ઝિન્દા હોને કી સૂરત મેં إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ
 આપ રો પડેંગે.

દુરુદ શરીફ કી ફઝીલત

રસૂલે નઝીર, સિરાજે મુનીર, મહબૂબે રબ્બે કદીર
 صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ કા ફરમાને દિલ પઝીર હૈ : ઝિક્રે ઇલાહી કી
 કસરત કરના ઔર મુઝ પર દુરુદે પાક પઠના ફકર (યા'ની તંગદસ્તી) કો
 દૂર કરતા હૈ. (الْقَوْلُ الْبَدِيع ص ૨૧૩)

صَلُّوْا عَلَيَّ الْحَبِيبِ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَيَّ مُحَمَّدٍ

શહજાદે ને યકાયક ચુપ સાધ લી. બાદશાહ ઔર
 વુ-ઝરા ઔર તમામ દરબારી હૈરાન હૈં કે આખિર ઇસ કો હો

1 : યેહ બયાન અમીરે અહલે સુન્નત صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ને તબ્લીગે કુરઆનો સુન્નત કી
 આલમગીર ગૈર સિયાસી તહરીક દા'વતે ઇસ્લામી કે આલમી મન્દની મર્કઝ ફૈઝાને
 મદીના કે અન્દર હફતાવાર સુન્નતોં ભરે ઇજતિમાઅ (9 જુમાદલ 1392 સિ.હિ./
 12-5-11) મેં ફરમાયા થા. તરમીમ વ ઇઝાફે કે સાથ તહરીરન હાઝિરે ખિદમત હૈ.

કરમાને મુસ્તફા વ્હલ્મુ ઘ્લોવાહે વ્હલ્મુ : જિસ ને મુઝ પર એક બાર દુરુદ પાક પઢા અલ્લાહ ઉસ પર દસ રહમતે ભેજતા હૈ. (મુ.)

ક્યા ગયા હૈ જો બોલતા નહીં ! સબ ને કોશિશ કર દેખી લેકિન શહઝાદા ખામોશ થા ખામોશ હી રહા. ખામોશી કે બા વુજૂદ શહઝાદે કે મા'મૂલાત મેં કોઈ ફર્ક નહીં આયા. એક દિન ખામોશ શહઝાદા અપને સાથિયોં કે હમરાહ પરન્દોં કા શિકાર ખેલને ચલા. કમાન પર તીર ચઢાએ એક ઘને દરખ્ત કે નીચે ખડા ઉસ મેં પરન્દા તલાશ કર રહા થા, ઈતને મેં દરખ્ત કે પત્તોં કે ઝુંડ કે અન્દર સે કિસી પરન્દે કે બોલને કી આવાઝ આઈ, બસ ફિર ક્યા થા, ઉસ ને ફૌરન આવાઝ કી સમ્ત તીર ચલા દિયા ઔર દેખતે હી દેખતે એક પરન્દા ઝખ્મી હો કર ગિરા ઔર તડપને લગા. ખામોશ શહઝાદા બે ઈખ્તિયાર બોલ ઉઠા : પરન્દા જબ તક ખામોશ થા સલામત રહા મગર બોલતે હી તીર કા નિશાના બન ગયા ઔર અફ્સોસ ! ઈસ કે બોલને કે સબબ મેં ભી બોલ પડા !

યુપ રહને મેં સો સુખ હેં તૂ ચેહ તજરિબા કર લે
એ ભાઈ ! ઝબાં પર તૂ લગા કુફલે મદીના

(વસાઈલે બખ્શિશ, સ. 66)

صَلُّوْا عَلَيَّ الْكَئِيبِ! صَلَّى اللهُ تَعَالَى عَلَيَّ مُحَمَّدٍ

ખામોશી મેં અમ્ન હૈ

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! ચેહ હિકાયત મન ઘડત હી સહી મગર ચેહ ના કાબિલે તરદીદ હકીકત હૈ કે બાતૂની શખ્સ દૂસરોં કો બોલને પર મજબૂર કર દેતા, અપના ઔર દીગર અફરાદ કા વક્ત બરબાદ કરતા, કઈ બાર બોલ કર પછતાતા ઔર બારહા પરેશાની ઉઠાતા હૈ, વાકેઈ ઈન્સાન જબ તક ખામોશ રહતા હૈ બહુત સારી આફતોં સે અમ્ન મેં રહતા હૈ.

﴿۱﴾ કરમાને મુસ્તફા علی اللہ تعالیٰ علیه و آله وسلم : જો શપ્સ મુઝ પર દુરુદ પાક પઢના ભૂલ ગયા વોહ જન્નત કા રાસ્તા ભૂલ ગયા. (ત્રાઉન)

બહરામ ઓર પરન્દા

કહતે હૈં : બહરામ કિસી દરખ્ત કે નીચે બૈઠા થા, ઉસે એક પરન્દે કી આવાઝ સુનાઈ દી ઓર ઉસ ને ઉસે માર ગિરાયા ફિર કહને લગા : ઝબાન કી હિફાઝત ઈન્સાન ઓર પરન્દે દોનોં કે લિયે મુફીદ હૈ અગર યેહ પરન્દા અપની ઝબાન સંભાલતા તો હલાક ન હોતા. (મુસ્તપરફ જ ૧ વ ૧૬૧)

ખામોશી કી ફઝીલત પર ચાર ફરામીને મુસ્તફા

﴿1﴾ યા'ની જો યુપ રહા ઉસ ને નજાત પાઈ. (તરમ્ઝી જ ૬ વ ૨૨૦ હદિથ ૨૦૦૧)
 ﴿2﴾ الصَّمْتُ سَيِّدُ الْأَخْلَاقِ (ખામોશી અખ્લાક કી સરદાર હૈ. (અલ્ફરુદોસ મમ્તૂર અલખટાબ જ ૨ વ ૬૧૭ હદિથ ૩૧૦).
 ﴿3﴾ الصَّمْتُ أَرْفَعُ الْعِبَادَةَ (ખામોશી આ'લા દ-રજે કી ઈબાદત હૈ. (અલ્ફરુદોસ મમ્તૂર અલખટાબ જ ૨ વ ૬૧૭ હદિથ ૩૧૦).
 ﴿4﴾ આદમી કા ખામોશી પર કાઈમ રહના 60 સાલ કી ઈબાદત સે બેહતર હૈ. (શુ'બુ'લ આયમાન જ ૬ વ ૨૬૦ હદિથ ૬૧૦૩)

60 સાલ કી ઈબાદત સે બેહતર કી વઝાહત

મુફસ્સિરે શહીર હકીમુલ ઉમ્મત હઝરતે મુફતી અહમદ ચાર ખાન عَلَيْهِ رَحْمَةُ الرَّحْمٰن યૌથી હદીસે પાક કે તહ્ત ફરમાતે હૈં : યા'ની અગર કોઈ શપ્સ સાઠ⁶⁰ સાલ કી ઈબાદત કરે મગર ઝિયાદા બાતેં ભી કરે, અચ્છી બુરી બાત મેં તમીઝ ન કરે ઈસ સે યેહ બેહતર હૈ કે થોડી દેર ખામોશ રહે ક્યૂંકે ખામોશી મેં ફિક ભી હુઈ, ઈસ્લાહે નફસ ભી, મઆરિફ વ હકાઈક મેં ઈસ્તિગરાક ભી, ઝિકે ખફી કે સમુન્દર મેં ગોતા લગાના ભી, મુરા-કબા ભી.

(મિરઆતુલ મનાજ્જહ, જિ. 6, સ. 361, મુપ્તસરન)

﴿करमाने मुस्तक﴾ على الله تعالى غيبوا له وسلم : जिस के पास मेरा जिक्र हुवा और उस ने मुझ पर दुर्दे पाक न पढा तलकिक वोड
 अदभप्त हो गया. (उरु)

झलतू आतों के चार लरगा भैर नुकसानात

“गपशप” करने वाले, आत का अतंगड बनाने वाले, अडके झुलू आत यूके ज़र्रर है गुनाह नहीं येह सोच कर या वैसे ही जो कभी कभार ही झुलू आतें करते हैं वोह भी झुलू आतों के मु-तअद्लिक हुज्जतुल इस्लाम हउरते सय्यिहुना इमाम अबू हामिद मुहम्मद बिन मुहम्मद बिन मुहम्मद गजाली عَلَيْهِ رَحْمَةُ اللَّهِ الْوَالِي के तअस्सुरात मुला-हउा इरमाअे और अपने आप को झुलू गुइत-गू के इन चार⁴ नुकसानात से डराअे. आप عَلَيْهِ رَحْمَةُ اللَّهِ تَعَالَى ने इन चार⁴ वुजूहात की बिना पर झुलू आतों की मउम्मत इरमाई है : ﴿1﴾ झुलू आतें किरामन कातिबीन (या’नी आ’माल लिखने वाले बुजुर्ग इरिशतों) को लिखनी पउती हैं, लिहाउा आदमी को याहिये के इन से शर्म करे और इन्हें झुलू आतें लिखने की उहमत न दे. अद्लाह عَزَّ وَجَلَّ पारह 26 सूरअे ﴿ق﴾, आयत नम्बर 18 में इशाई इरमाता है :

مَا يَلْفُظُ مِنْ قَوْلٍ إِلَّا لَدَيْهِ رَقِيبٌ عَتِيدٌ ﴿١٨﴾

तर-ज-मअे कनुल इमान : कोई आत वोह उबान से नहीं निकालता के उस के पास अेक मुहाकिउ तय्यार न भैठा हो.

﴿2﴾ येह आत अखी नहीं के झुलू आतों से लरपूर आ’माल नामा अद्लाह عَزَّ وَجَلَّ की बारगाह में पेश हो ﴿3﴾ अद्लाह عَزَّ وَجَلَّ के दरबार में तमाम मज्लूक के सामने अन्दे को हुकम होगे के अपना आ’माल नामा पढ कर सुनाओ ! अब कियामत की भौइनाक सप्तियां उस के सामने होंगी, इन्सान अरहुना (या’नी नंगा) होगे, सप्त थ्यासा होगे,

﴿قرآن کریم﴾ : ﴿قُلِ اللَّهُ غَفُورٌ رَحِيمٌ﴾ : جس نے مومنوں کو بخش دیا اور ان کے گناہوں کو مٹا دیا۔
 ﴿قرآن کریم﴾ : ﴿قُلِ اللَّهُ غَفُورٌ رَحِيمٌ﴾ : جس نے مومنوں کو بخش دیا اور ان کے گناہوں کو مٹا دیا۔

ਭੁੱਕ ਸੇ ਕਮਰ ਟੂਟ ਰਹੀ ਢੋਗੀ, ਜੰਨਤ ਮੇਂ ਜਾਨੇ ਸੇ ਰੋਕ ਢਿਆ ਗਯਾ ਢੋਗਾ ਐਰ ਢਰ ਕਿਸਮ ਕੀ ਰਾਢਤ ਉਸ ਪਰ ਭਨੁਦ ਕਰ ਢੀ ਗਈ ਢੋਗੀ, ਗੌਰ ਤੋ ਕੀਜਿਯੇ ਐਸੇ ਤਕਲੀਫ਼ ਢੇਢ ਢਾਢਾਤ ਮੇਂ ਢੁਜੂਲ ਭਾਤੋਂ ਸੇ ਭਰਪੂਰ ਆ'ਮਾਲ ਨਾਮਾ ਪਢ ਕਰ ਸੁਨਾਨਾ ਕਿਸ ਕਢਰ ਪਰੇਸ਼ਾਨ ਢੁਨ ਢੋਗਾ ! (ਢਿਸਾਭ ਲਗਾਢਯੇ ਅਗਰ ਰੋਜਾਨਾ ਸਿਫ਼ 15 ਮਿਨਟ ਭੀ ਢੁਜੂਲ ਭਾਤੋਂ ਕੀ ਢੈਂ ਤੋ ਐਕ ਮਢੀਨੇ ਕੇ ਸਾਢੇ ਸਾਤ ਢਨੁਦੇ ਢੁਐ ਐਰ ਐਕ ਸਾਲ ਕੇ 90 ਢਨੁਦੇ, ਭਿਲਫ਼ੜ ਕਿਸੀ ਨੇ ਪਯਾਸ ਸਾਲ ਤਕ ਰੋਜਾਨਾ ਐ-ਸਤਨ 15 ਮਿਨਟ ਢੁਜੂਲ ਗੁਫ਼ਤ-ਗੂ ਕੀ ਤੋ 187 ਢਿਨ 12 ਢਨੁਦੇ ਢੁਐ ਯਾ'ਨੀ ਢ ਮਾਢ ਸੇ ਝਾਢਢ, ਤੋ ਗੌਰ ਢਰਮਾਢਯੇ ! ਕਿਆਮਤ ਕਾ ਢੋਲਨਾਕ ਢਿਨ ਜਿਸ ਮੇਂ ਸੂਰਜ ਸਿਫ਼ ਸਵਾ ਮੀਲ ਪਰ ਰਢ ਕਰ ਆਗ ਭਰਸਾ ਰਢਾ ਢੋਗਾ, ਐਸੀ ਢੋਸ਼ਰੁਭਾ ਗਰਮੀ ਮੇਂ ਮੁਸਢਲ ਭਿਲਾ ਵਕਫ਼ਾ ਢ ਮਾਢ ਤਕ ਕੌਨ "ਆ'ਮਾਲ ਨਾਮਾ" ਪਢ ਕਰ ਸੁਨਾ ਸਕੇਗਾ ! ਯੇਢ ਤੋ ਸਿਫ਼ ਯੌਮਿਯਾ ਪਨੁਦਰਢ ਮਿਨਟ ਕੀ ਢੁਜੂਲ ਗੋਢ ਕਾ ਢਿਸਾਭ ਢੈ. ਢਮਾਰੇ ਤੋ ਭਸਾ ਅਵਕਾਤ ਕਈ ਕਈ ਢਨੁਦੇ ਢੋਸ਼ਤੋਂ ਕੇ ਸਾਢ "ਢੁਜੂਲ ਗਪਸਪ" ਮੇਂ ਗੁਝਰ ਜਾਤੇ ਢੈਂ, ਗੁਨਾਢੋਂ ਭਰੀ ਭਾਤੋਂ ਐਰ ਢੀਗਰ ਭੁਰਾਢਯਾਂ ਮਝੀਢ ਭਰਆਂ) ﴿4﴾ ਭਰੋਝੇ ਕਿਆਮਤ ਭਨੁਦੇ ਕੋ ਢੁਜੂਲ ਭਾਤੋਂ ਪਰ ਮਲਾਮਤ ਕੀ ਜਾਐਗੀ ਐਰ ਉਸ ਕੋ ਸ਼ਰਮਿਨੁਦਾ ਕਿਆ ਜਾਐਗਾ. ਭਨੁਦੇ ਕੇ ਪਾਸ ਢਸ ਕਾ ਕੋਢ ਜਵਾਭ ਨ ਢੋਗਾ ਐਰ ਵੋਢ ਅਢਲਾਢ عَزَّوَجَلَّ ਕੇ ਸਾਮਨੇ ਸ਼ਰਮ ਵ ਨਢਾਮਤ ਸੇ ਪਾਨੀ ਪਾਨੀ ਢੋ ਜਾਐਗਾ.

(منهاج العابدین ص 67)

ਢਰ ਲਫ਼ਝ ਕਾ ਕਿਸ ਢਰਢ ਢਿਸਾਭ ਆਢ ! ਮੈਂ ਢੂੰਗਾ

ਅਢਲਾਢ ਝਭਾਂ ਕਾ ਢੋ ਅਤਾ ਢੁਫ਼ਲੇ ਮਢੀਨਾ

(ਵਸਾਢਲੇ ਭਾਫ਼ਿਸ਼, ਸ. 66)

صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

ફરમાને મુસ્નફા علی اللہ تعالیٰ علیه وآله وسلم : जिस के पास मेरा जिक्र हुआ और उस ने मुझ पर दुर्दृष्ट शरीफ़ न पड़ा उस ने जफ़ा की. (महाजरा)

સબ સે ઝિયાદા નુક્સાન દેહ ચીઝ

رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ اَللّٰهُ تَعَالَى عَلَيْنَا سُبْحَانَ بِنِ اَبَدُ لَلّٰهُ

ફરમાતે હૈં : એક બાર મેં ને બારગાહે રિસાલત મેં અર્ઝ કી : યા રસૂલલ્લાહ (સલ્લુલ્લાહુ આલૈહિ વાલ્હિ વસલ્મ) ! આપ મેરે લિયે સબ સે ઝિયાદા ખતરનાક ઓર નુક્સાન દેહ ચીઝ કિસે કરાર દેતે હૈં ? તો સરકારે મદીના સલ્લુલ્લાહુ આલૈહિ વાલ્હિ વસલ્મ ને અપની ઝબાને મુબારક પકડ કર ઇશ્દિ ફરમાયા : “ઈસે.”

(سُنَنِ تِرْمِذِي ج ٤ ص ١٨٤ حَدِيث ٢٤١٨)

ભલાઈ કી બાત કરો યા ચુપ રહો

કાશ ! બુખારી શરીફ કી યેહ હદીસે પાક હમારે ઝેહનો

દિમાગ મેં રાસિખ હો જાએ, જિસા મેં યેહ ભી હૈ : “જો અલ્લાહ ઓર કિયામત પર ઈમાન રખતા હૈ ઉસે યાહિયે કે ભલાઈ કી બાત કરે યા ખામોશ રહે.” (بخاری ج ٤ ص ١٠٥ حَدِيث ٦٠١٨)

ઈશાઅતી ઈદારે મક-ત-બતુલ મદીના કી મત્બૂઆ 217 સફહાત પર મુશ્તમિલ કિતાબ, “અલ્લાહ વાલોં કી બાતેં” સફહા 91 પર અમીરુલ મુઅમિનીન, હઝરતે સય્યિદુના સિદ્દીકે અકબર રَضِيَ اللهُ تَعَالَى عَنْهُ ફરમાતે હૈં : “ઉસ બાત મેં કોઈ ભલાઈ નહીં જિસ સો મક્સૂદ અલ્લાહ (عَزَّوَجَلَّ) કી ખુશનૂદી ન હો.”

હઝરતો સય્યિદુના ઈમામ સુફ્યાન સૌરી (جَلِيَّةُ الْاَوْلِيَاء ج ١ ص ٧١) رَحْمَةُ اللهِ تَعَالَى عَلَيْه ને ફરમાયા : ઈબાદત કા અવ્વલ ખામોશી હોતી હૈ, ફિર ઈલ્મ હાસિલ કરના, ઈસ કે બા'દ ઉસે યાદ કરના, ફિર ઉસ પર અમલ કરના ઓર ઉસે ફેલાના.

(تاريخ بغداد ج ٦ ص ٦)

﴿فَرَمَانٌ مُّسْتَكْبِرٌ عَلَى اللَّهِ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ﴾ : ज़े मुज़ पर रोज़ ज़ुमुआ हुइद शरीफ़ पड़ेगा में क़ियामत के दिन उस की शक़ाअत करूंगे। (अमल)

अगर जन्नत दरकार हो तो.....

उज़रते सय्यिहुना ईसा इहुल्लाह عَلَى نَبِيِّنَا وَعَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَام इहुल्लाह की भिदमते बा अ-उमत में लोगों ने अर्ज़ किया : कोई ऐसा अमल बताईये के जिस से जन्नत मिले. ईशाई इरमाया : “कभी बोलो मत.” अर्ज़ की : येह तो नहीं हो सकता. इरमाया : “अच्छी बात के सिवा उबान से कुछ मत निकालो.”

(احياء العلوم ج ۳ ص ۱۳۶)

अकसर मेरे छोटों पे रहे ठिके मदीना

अल्लाह जबां का हो अता कुइले मदीना

(वसाईले बफ़िशिश, स. 66)

صَلُّوْا عَلَيَّ الْحَبِيْب! صَلَّى اللهُ تَعَالَى عَلَيَّ مُحَمَّد

भामोशी इमान की सलामती का जरीआ है

जिस बद नसीब की उबान कैंची की तरह हर किसी की बात काटती यली जाती होगी, वोह दूसरे की बात अच्छी तरह समजने से महइम रहेगा बल्के बातूनी शफ्स के लिये येह भी अतरा रहता है के बक बक करते हुअे उबान से क़ुइय्यात निकल जाअें. युनाच्चे इहुजतुल ईस्लाम उज़रते सय्यिहुना इमाम अबू हामिद मुहम्मद बिन मुहम्मद बिन मुहम्मद गजाली عَلَيْهِ رَحْمَةُ اللهِ الْوَالِي “अेहयाउल उलूम” में बा’ज बुजुर्गों का कौल नकल करते हुअे इरमाते हैं : भामोश रहने वाले शफ्स में दो भूबियां जम्अ हो जाती हैं 1) उस का दीन सलामत रहता है और 2) दूसरे की बात अच्छी तरह समज लेता है.

(احياء العلوم ج ۳ ص ۱۳۷)

ફરમાને મુસ્તફા : عَلَى اللَّهِ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : મુઝ પર દુરુદે પાક કી કસરત કરો બેશક યેહ તુમહારે લિયે તહારત હૈ. (અબુ ડાવુદ)

ખામોશી જાહિલ કા પર્દા હૈ

હઝરતે સય્યિદુના સુફ્યાન બિન ઉયૈના عَلَيْهِ رَحْمَةُ اللَّهِ تَعَالَى نِه

ફરમાયા : الصَّمْتُ زَيْنٌ لِلْعَالِمِ وَسِتْرٌ لِلْجَاهِلِ ખામોશી આલિમ કા વકાર
ઔર જાહિલ કા પર્દા હૈ.

(شُعَبُ الْإِيمَانِ ج ٧ ص ٨٦ حديث ٤٧٠١)

ખામોશી ઇબાદત કી યાબી હૈ

હઝરતે સય્યિદુના ઇમામ સુફ્યાન અલ્હન્નَان عَلَيْهِ رَحْمَةُ اللَّهِ تَعَالَى نِه સે મરવી હૈ :

ઝિયાદા ખામોશી ઇબાદત કી યાબી હૈ.

(الصَّمْتُ مَعَ مَوْسُوْعَةِ ابْنِ أَبِي الدُّنْيَا ج ٧ ص ٢٥٥ رقم ٤٣٦)

માલ કી હિફાઝત આસાન હૈ મગર ઝબાન.....

હઝરતે સય્યિદુના મુહમ્મદ બિન વાસેઅ عَلَيْهِ رَحْمَةُ اللَّهِ تَعَالَى نِه

હઝરતે સય્યિદુના માલિક બિન દીનાર عَلَيْهِ رَحْمَةُ اللَّهِ تَعَالَى نِه સે ફરમાયા :
ઈન્સાન કે લિયે ઝબાન કી હિફાઝત માલ કી હિફાઝત સે ઝિયાદા
દુશ્વાર હૈ.

(اتحاف السادة للريدي ج ٩ ص ١٤٤)

અફસોસ ! કે અપને માલ કી હિફાઝત કે મુઆ-મલે મેં ઉમૂમન

હર એક હોશિયાર હોતા હૈ, હાલાંકે માલ ઝાએઝ હો ભી ગયા તો
સિર્ફ દુન્યા કા નુક્સાન હૈ. સદ કરોઃ અફસોસ ! ઝબાન કી હિફાઝત
કી સોચ નિહાયત કમ રહ ગઈ હૈ, યકીનન ઝબાન કી હિફાઝત ન
કરને કે સબબ દુન્યા કે નુક્સાન કે સાથ સાથ આખિરત કી બરબાદી
કા ભી પૂરા પૂરા ઇમ્કાન હૈ.

करमाने मुस्तक! صلى الله تعالى عليه وآله وسلم : तुम जहां भी हो मुझ पर दुर्रद पढो के तुम्हारा दुर्रद मुझ तक
पहोचता है. (طرائف)

अक अक की येह आदत न सरे उशर ईसा दे

अद्लाह जहां का हो अता कुईले मदीना

(वसाईले अफ्शिश, स. 66)

صَلُّوْا عَلَيَّ الْحَبِيْب! صَلَّى اللهُ تَعَالَى عَلَيَّ مُحَمَّد

बोलने वाला भारहा पछताता है

मीठे मीठे ईस्लामी भाईयो ! येह ना काबिले तरदीद हकीकत

है के आमोश रहने में नदामत का ईम्कान बहुत कम है जब के मौकअ बे

मौकअ “बोल पडने” की आदत से भारहा SORRY कडना पडता

और मुआई मांगनी पडती है या फिर दिल् ही दिल् में पछतावा होता

है के मैं यहां न बोला होता तो अश्या था क्यूंके मेरे बोलने पर सामने

वाले की जिजक उड गई, जरी जरी सुननी पडी, कुलां नाराज हो गया,

कुलां का येहरा उतर गया, कुलां का दिल् दुख गया. अपना वकार भी

मजदुह हुवा वगैरा वगैरा. उजरते सय्यिदुना मुहम्मद बिन नज्द

हारिसी عَلَيْهِ رَحْمَةُ اللهِ الْقَوِي से मरवी है : जियादा बोलने से वकार

(दबदबा) जाता रहता है. (الصَّمْتُ لِأَبِي الدُّنْيَا ج ٧ ص ٦٠ رقم ٥٢)

“बोल कर” पछताने से “न बोल कर” पछताना अश्या

सय है, “बोल कर” पछताने से “न बोल कर” पछताना

अश्या और “जियादा आ कर” पछताने से “कम आ कर” पछताना

अश्या के जो बोलता रहता है वोह मुसीबतों में ईंसता रहता है और

जो जियादा जाने का आदी होता है वोह अपना मे’दा तबाह कर

बैठता, अकसर भोटापे का शिकार हो जाता और तरह तरह की

बीमारियों की जद में रहता है, अगर जवानी में अमराज से कदरे

﴿فَرَمَانٌ مُّسْتَكْفٍا طَلَى اللّٰهَ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ﴾ : જિસ કે પાસ મેરા ઝિક હો ઓર વોહ મુઝ પર દુરુદ શરીફ ન પઢે તો વોહ લોગોં મેં સે કન્જૂસ તરીન શાખ્સ હે. (તર્જીમ)

બચત હો ભી ગઈ તો જવાની ઢલને કે બા'દ બસા અવકાત “સરાપા મરઝ” બન જાતા હૈ. ઝિયાદા ખાને કે નુક્સાનાત ઓર મોટાપે કે ઇલાજ વગૈરા જાનને કે લિયે ફૈઝાને સુન્નત જિલ્દ અવ્વલ કે બાબ “પેટ કા કુફલે મદીના” કા મુતા-લઆ ફરમાઈયે.

ગૂંગા ફાએદે મેં રહતા હૈ

મીઠે મીઠે ઇસ્લામી ભાઈયો ! દેખા જાએ તો નાબીના ફાએદે મેં રહતા હૈ કે ગૈર ઓરતોં કો ઘૂરને, અમ્રદોં પર લઝઝત ભરી નિગાહેં ડાલને, ફિલ્મેં ડિરામે દેખને, કિસી “હાફ પેન્ટ” વાલે કે ખુલે ઘુટને ઓર રાનેં દેખને વગૈરા વગૈરા બદ નિગાહિયોં કે ગુનાહોં સે બચા રહતા હૈ. ઇસી તરહ ગૂંગા ભી ઝબાન કી બે શુમાર આફતોં સે મહફૂઝ રહતા હૈ. અમીરુલ મુઅમિનીન હઝરતે સય્યિદુના અબૂ બક સિદ્દીક ફરમાતે હૈં : કાશ મૈં ગૂંગા હોતા મગર ઝિકુલ્લાહ કી હદ તક ગોયાઈ (યા'ની બોલને કી સલાહિયત) હાસિલ હોતી.

(۵۸۲۶ تحت الحديث ج ۱۰ ص ۸۷) “એહયાઉલ ઉલૂમ” મેં હૈ, હઝરતે સય્યિદુના અબૂ દરદા رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ ને એક ઝબાન દરાઝ ઓરત દેખી તો ફરમાયા : અગર યેહ ગૂંગી હોતી તો ઇસ કે હક મેં બેહતર થા.

(احياء العلوم ج ۳ ص ۱۴۲)

ઘર અમ્ન કા ગહવારા કૈસે બને !

પ્યારે પ્યારે આકા صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ કે મીઠે મીઠે સહાબી رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ કે ઇશાદિ સે ખુસૂસન હમારી વોહ ઇસ્લામી બહનેં દર્સ હાસિલ કરેં જો હર વક્ત “લગાઈ બુઝાઈ” ઓર “તેરી મેરી” મેં મગન રહતીં ઓર ઇધર કી ઉધર ઓર ઉધર કી ઇધર લગાને સે ફુરસત

﴿ کرمانہ مستحکم علی غلواہ وسلم : اسی شہس کی ناک پاک آلودہ ہو جس کے پاس میرا ٹیکہ ہو اور وہ مجھ پر دھڑکے پاک نہ پڑے. ﴾ (۶)

નહીં પાતીં. અગર ઈસ્લામી બહનેં સહીહ મા'નોં મેં અપની ઝબાન પર “કુફ્લે મદીના” લગા લેં તો ઈન કી ઘરેલૂ પરેશાનિયાં, રિશ્તેદારોં સે ના ચાક્રિયાં ઓર સાસ બહૂ કી લડાઈયાં વગૈરા બહુત સારે મસાઈલ હલ હો જાએં ઓર સારે કા સારા ખાનદાન અમ્ન કા ગહવારા બન જાએ ક્યૂંકે ઝિયાદા તર ઘરેલૂ ઝગડે ઝબાન કે બે જા ઈસ્તિ'માલ હી કે સબબ હોતે હેં.

સાસ બહૂ કા ઝગડા નિમટાને કા મ-દની નુસ્ખા

સાસ અગર ડાંટ ડપટ કરતી હો તો “બહૂ” કો ચાહિયે કે સિઈ ઓર સિઈ સબ્ર કરે, અપની સાસ કો જવાબન એક લફઝ ભી ન કહે ઓર અપને શોહર કો ભી શિકાયત ન કરે, અપને મયકે મેં ભી કુછ ન બતાએ બલકે મુંહ ભી ન ચઢાએ, નીઝ અપને બચ્ચોં યા બરતનોં વગૈરા પર ભી ગુસ્સા ન નિકાલે. إِنَّ كَاثِرًا مِّنَ النَّاسِ كَاثِرُونَ કામ્યાબી ઉસ કે કદમ ચૂમ લેગી. કહા જાતા હૈ : “એક ચુપ સો¹⁰⁰ કો હરાએ.” ઈસી તરહ અગર કોઈ બહૂ અપની “સાસ” સે ઝગડા કરતી હો તો સાસ કો ચાહિયે કે બિલ્કુલ જવાબી કારવાઈ ન કરે, સિઈ ખામોશી હી ઈખ્તિયાર કરે ઘર કે કિસી ફર્દ હત્તા કે અપને બેટે કો ભી શિકાયત ન કરે. إِنَّ كَاثِرًا مِّنَ النَّاسِ كَاثِرُونَ ઈસ કહાવત, “એક ચુપ સો¹⁰⁰ સુખ” કે મુતાબિક સુખ ચૈન પાએગી. જી હાં અગર સહીહ મા'નોં મેં સગે મદીના عَلَىٰ غُلُوٰهٍ કે ઈસ “મ-દની નુસ્ખે” પર અમલ ક્રિયા ગયા તો إِنَّ كَاثِرًا مِّنَ النَّاسِ كَاثِرُونَ જલ્દ હી સાસ બહૂ કી લડાઈ ખત્મ હો જાએગી ઓર ઘર અમ્ન કા ગહવારા બન જાએગા. સાસ બહૂ કે ઝગડોં કે ઈલાજ કે લિયે હિક્મત ભરે મ-દની ફૂલોં પર મુશ્તમિલ V.C.D. “ઘર અમ્ન કા ગહવારા કેસે બને !” મક-ત-બતુલ મદીના સે હાસિલ કીજિયે

ફરમાને મુસ્તફા ﷺ : عَلَى اللَّهِ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : जिस ने मुझ पर रोझे खुशुआ दो सो बार दुरेद पाक पढा उस के दो सो साल के गुनाह मुआफ़ होंगे. (अबान)

યા દા'વતે ઈસ્લામી કી વેબ સાઈટ : WWW.DAWATEISLAMI.NET
પર મુલા-હઝા ફરમાઈયે. اَلْحَمْدُ لِلّٰهِ عَزَّوَجَلَّ ઈસ v.c.d. કી બ-ર-કત સે કઈ ઘર અમ્ન કા ગહવારા બન ચુકે હેં !

હે દબદબા ખામોશી મેં હેબત ભી હે પિન્હાં

ઐ ભાઈ ! ઝબાં પર તૂ લગા કુફલે મદીના

(વસાઈલે બખ્શિશ, સ. 66)

صَلُّوْا عَلَيَّ الْحَبِيْب! صَلَّى اللهُ تَعَالَى عَلَيَّ عَلِيٍّ مُحَمَّد

ઝબાન કી ખિદમત મેં દર-ખવાસ્ત

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! જબ ઝબાન સીધી રહેગી ઓર ઈસ સે અચ્છી અચ્છી બાતોં કા સિલ્સિલા હોગા તો ઈસ કા ફાએદા સારા હી જિસ્મ ઉઠાએગા ઓર અગર યેહ ટેઢી ચલી મ-સલન કિસી કો ઝિડકા, ગાલી દી, કિસી કી બે ઈઝ્ઝતી કર દી, ગીબત વ ચુગલી કી, ઝૂટ બોલા તો બસા અવકાત દુન્યા મેં ભી જિસ્મ કી પિટાઈ હો જાતી હે. હમારે મીઠે મીઠે પ્યારે પ્યારે ઓર સબ સે અચ્છે ઓર ખુશ અખ્લાક આકા صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ કા ફરમાને બા સફા હે : “જબ ઈન્સાન સુબહ કરતા હે તો ઉસ કે આ'ઝા ઝુક કર ઝબાન સે કહતે હેં, હમારે બારે મેં અલ્લાહ (عَزَّوَجَلَّ) સે ડર કયૂંકે હમ તુઝ સે વાબસ્તા હેં અગર તૂ સીધી રહેગી તો હમ ભી સીધે રહેંગે ઓર અગર તૂ ટેઢી હો ગઈ તો હમ ભી ટેઢે હો જાએંગે.” (سُنَنِ تِرْمِذِي ج ٤ ص ١٨٣ حديث ٢٤١٠)

યા રબ ન ઝરૂરત કે સિવા કુછ કભી બોલૂં !

અલ્લાહ ઝબાં કા હો અતા કુફલે મદીના

(વસાઈલે બખ્શિશ, સ. 66)

صَلُّوْا عَلَيَّ الْحَبِيْب! صَلَّى اللهُ تَعَالَى عَلَيَّ عَلِيٍّ مُحَمَّد

ફરમાને મુસ્તફા صَلَّی اللہُ تَعَالَى عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم : મુઝ પર દુરૂદ શરીફ પઢો અલ્લાહ عَزَّوَجَلَّ તુમ પર રહમત ભેજેગા. (ابن عمر)

અચ્છી બાત કરને કી ફઝીલત

તાજદારે રિસાલત, માલિકે કૌસરો જન્નત

صَلَّى اللہُ تَعَالَى عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم کا ફરમાને જન્નત નિશાન હૈ : જન્નત મેં એસે બાલાખાને હેં જિન કા બાહર અન્દર સે ઓર અન્દર બાહર સે દેખા જાતા હૈ. એક આ'રાબી ને ઉઠ કર અર્ઝ કી : યા રસૂલલ્લાહ صَلَّی اللہُ تَعَالَى عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم ! યેહ કિસ કે લિયે હેં ? આપ صَلَّی اللہُ تَعَالَى عَلَیْہِ وَاٰલِہٖ وَسَلَّم ને ઈર્શાદ ફરમાયા : યેહ ઉસ કે લિયે હેં જો અચ્છી ગુફત-ગૂ કરે, ખાના ખિલાએ, મુતવાતિર રોઝે રખે, ઓર રાત કો ઉઠ કર અલ્લાહ عَزَّوَجَلَّ કે લિયે નમાઝ પઢે જબ લોગ સોએ હુએ હોં. (سَنَنْ تَرْمِذِي ج ٤ ص ٢٣٧ حديث ٢٥٣٥)

صَلَّى اللہُ تَعَالَى عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم

આકા તવીલ ખામોશી વાલે થે

یا'ની کَانَ رَسُولُ اللّٰهِ صَلَّی اللّٰهُ عَلَیْہِ وَسَلَّم طَوِيلَ الصَّمْتِ -

રસૂલલ્લાહ صَلَّی اللہُ تَعَالَى عَلَیْہِ وَاٰલِہٖ وَسَلَّم તવીલ ખામોશી વાલે થે. (شرحُ السُّنَّةِ لِلْبَغَوِيِّ ج ٧ ص ٤٥ حديث ٣٥٨٩) મુફ્ફિસિરે શહીર હકીમુલ ઉમ્મત હઝરતે મુફ્ફતી અહમદ યાર ખાન عَلَيْهِ رَحْمَةُ اللّٰهِ عَلَیْہِ ઈસ હદીસે પાક કે તહ્ત ફરમાતે હેં : ખામોશી સે મુરાદ હૈ દુન્યાવી કલામ સે ખામોશી વરના હુઝૂરે અકદસ (صَلَّى اللہُ تَعَالَى عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم) કી ઝબાન શરીફ અલ્લાહ (عَزَّوَجَلَّ) કે ઝિક મેં તર રહતી થી, લોગોં સે બિલા ઝરૂરત કલામ નહીં ફરમાતે થે. યેહ ઝિક હૈ જાઈઝ કલામ કા, ના જાઈઝ કલામ તો ઉમ્મ ભર ઝબાન શરીફ પર આયા હી નહીં. જૂટ, ગીબત, યુગલી વગૈરા સારી ઉમ્મ શરીફ મેં એક બાર ભી ઝબાને મુબારક પર ન આએ.

इरमाने मुस्तफ़ा : صلى الله تعالى عليه وآله وسلم : मुज पर कसरत से दुइदे पाक पढे बेशक तुम्हारा मुज पर दुइदे पाक पढना तुम्हारे गुनाहों के लिये मगफ़िरत है. (भा.सं.)

हुजूर (صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ) सरापा हक हें फिर आप तक बातिल की रसाई कैसे हो. (मिरआतुल मनाज्जिद, जि. 8, स. 81)

बोलने और चुप रहने की दो किस्में

इरमाने मुस्तफ़ा : صلى الله تعالى عليه وآله وسلم है :

يَا خَيْرٌ مِنَ السُّكُوتِ وَالسُّكُوتُ خَيْرٌ مِنَ إِمْلَاءِ الشَّرِّ आमोशी से बेहतर है और आमोश रहना बुरी बात कहने से बेहतर है. (شُعَبُ الْإِيمَانِ ج ٧ ص ٥٨ حديث ٤٦٣٩) हुजरते सय्यिदुना अली बिन उस्मान डिजवेरी अल मा'रुफ़ दाता गन्ज बप्श **“कश्कुल मड्जूब”** में इरमाते हें : कलाम (या'नी बोलना) दो² तरह का होता है. एक कलामे हक और दूसरा कलामे बातिल, ईसी तरह आमोशी भी दो² तरह की होती हें : (1) आ मक्सद (म-सलन किके आभिरत या शर-ई अहकाम पर गौरो भौज वगैरा के लिये) आमोशी (या'नी चुप रहना) (2) गफ़लत भरी (या **مَعَادَا اللهُ** गन्टे तसव्वुरात या हुन्या के बे जा जयालात से भरपूर) आमोशी. हर शप्स को सुकूत (या'नी आमोशी) की हालत में भूब अख़ी तरह गौर कर लेना याहिये के अगर ईस का बोलना हक है तो बोलना उस की आमोशी से बेहतर है और अगर ईस का बोलना बातिल है तो उस की आमोशी उस के बोलने से बेहतर है. हुजूर दाता गन्ज बप्श **رَحْمَةُ اللهِ تَعَالَى عَلَيْهِ** गुफ़्त-गू के हक या बातिल होने के मु-तअव्लिक समजाने के लिये एक डिक्कायत नकल करते हुअे इरमाते हें : एक मर्तबा हुजरते सय्यिदुना अबू बक़ शिबली बगदादी **رَحْمَةُ اللهِ تَعَالَى عَلَيْهِ** बगदाद शरीफ़ के एक मडल्ले से गुजरते हुअे एक शप्स को सुना वोह कह रहा था :

કરમાને મુસ્તફા صلى الله عليه وآله وسلم : જો મુઝ પર એક દુરુદ શરીફ પઢેતા હે અલલાહ મુઝને ઉસ કે લિયે એક કીરાત અજર લિખતા હે ઓર કીરાત ઉહુદ પહાડ જિતના હે. (Jizyah)

مَلِكُ الْكَلَامِ يَا'ની ખામોશી બોલને સે બેહતર હૈ. આપ ﷺ ने उसे ફરमाया : “तेरे बोलने से तेरा खामोश रहना अच्छा है और मेरा बोलना खामोश रहने से बेहतर है.”

(ماخوذ از كشف المحجوب ص ۶۰۲)

ફોહ્શ બાત કી તા'રીફ

કિતને ખુશ નસીબ હૈં વોહ ઈસ્લામી ભાઈ ઓર ઈસ્લામી બહને ! જો સિફ અચ્છી ગુફત-ગૂ કે લિયે હી ઝબાન કો હ-ર-કત મેં લાતે ઓર ખૂબ ખૂબ “નેકી કી દા'વત” લોગોં તક પહોંચાતે હૈં. અફસોસ ! આજ કલ લોગોં કી બહુત હી કમ બૈઠકેં ઐસી હોતી હોંગી જો ફોહ્શ બાતોં સે પાક હોં હતા કે મઝહબી વઝૂઅ કત્અ કે અફરાદ ભી ઈસ સે બચ નહીં પાતે. શાયદ ઉન્હેં યેહી નહીં પતા હોતા કે ફોહ્શ બાત કિસે કહતે હૈં ! તો સુનિયે : ફોહ્શ બાત કી તા'રીફ યેહ હૈ : الأَمُورِ الْمُسْتَقْبَحَةِ بِالْعِبَارَاتِ الصَّرِيحَةِ يَا'ની શર્મનાક ઉમૂર (મ-સલન ગન્દે ઓર બુરે મુઆ-મલાત) કા ખુલે અલ્ફાઝ મેં તઝકિરા કરના. (احياء العلوم ج ۳ ص ۱۵۱) તો વોહ નૌ જવાન જો શહૂવત કી તસ્કીન કી ખાતિર ખ્વાહ મ ખ્વાહ શાદિયોં કી ખલ્વતોં ઓર પર્દે મેં રખને કી બાતોં કે કિસ્સે છોડતે હૈં, નીઝ ફોહ્શ યા'ની બે હયાઈ કી બાતેં કરને વાલે બલ્કે સિફ સુન કર દિલ બહલાને વાલે, ગન્દી ગાલિયાં ઝબાન પર લાને વાલે, બે શર્માના ઈશારે કરને વાલે, ઉન ગન્દે ઈશારોં સે લુલ્ફ અન્દોઝ હોને વાલે ઓર “ગન્દી લઝઝતોં” કે હુસૂલ કી ખાતિર ફિલ્મેં ડિરામે (કે ઈન મેં ઉમૂમન બે હયાઈ કી ભરમાર હોતી હૈ) દેખને વાલે એક દિલ હિલા

करमाने मुस्तफ़ा صلى الله عليه وآله وسلم : जिस ने किताब में मुज पर दुर्इदे पाक लिखा तो जब तक मेरा नाम उस में रहेगा फिरिश्ते उस के लिये ईस्तिग्फ़ार करते रहेंगे. (७/१)

देने वाली रिवायत बार बार पढ़ें और षौक़े भुदा वन्दी से लरजें युनान्चे

मुंह से भून और पीप बह रहा होगा

मन्कूल है : यार तरह के जहन्नमी जो के षौलते पानी और आग के भाबैन (या'नी दरमियान) भागते फिरते वैल व सुभूर (या'नी हलाकत) मांगते छोंगे, उन में से अेक वोह शप्स के उस के मुंह से भून, पीप बह रहा होगा, जहन्नमी कहेंगे : “ईस बढ भप्त को क्या हुवा के हमारी तकलीफ़ में ईजाफ़ा किये देता है ?” कछा ज़ाअेगा : “येह बढ भप्त भुरी और भबीस (या'नी गन्दी) भात की तरफ़ मु-तवज्जोह हो कर उस से लज़्जत उठाता था जैसा के जिमाअ की भातों से.” (اتحاف السادة للزبيدي ج ٩ ص ١٨٧) गैर औरतों या अमरदों के बारे में आने वाले गन्टे वस्वसों पर तवज्जोह जमाने, ज़ान भूज कर भुरे भयालात में भुद को गुमाने और مَعَادُ اللَّهِ, “गन्दी ह-र-कत” के तसप्पुर के ज़रीअे लज़्जत उठाने वालों को भयान कर्दा रिवायत से ईअ्रत हासिल करनी याहिये.

न वस्वसे आअें न मुजे गन्टे भयालात

दे जेहन का और दिल का भुदा ! कुइले मदीना

(वसाईले बफ़िश, स. 66)

صَلُّوْا عَلَى الْحَبِيبِ ! صَلَّى اللهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

कुते की शकल वाला

उजरते सय्यिहुना ईअ्राडीम भिन मैसरह رَحْمَةُ اللهِ تَعَالَى عَلَيْهِ
 इरमाते हें : “इोइश कलामी (या'नी बे हयाई की भातें) करने

ફરમાને મુસ્તકા صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : जिस ने मुझ पर एक बार दुइडे पाक पढा अल्लाह उस पर दस रइमतें भेजता है. (مسلم)

વાલા કિયામત કે દિન કુત્તે કી શક્લ મેં આએગા.”

(اتحاف السَّاتَةِ لِلرَّبِيدِي ج ٩ ص ١٩٠)

જન્નત હરામ હૈ

હુઝૂર તાજદારે મદીના, કરારે કલ્બો સીના, સાહિબે મુઅત્તર પસીના صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ का ફરમાને બા કરીના હૈ :
“ઉસ શખ્સ પર જન્નત હરામ હૈ જો ફોદ્દશ ગોઈ (યા’ની બે હયાઈ કી બાત) સે કામ લેતા હૈ.”

(الصَّنْت لِابْنِ أَبِي الدُّنْيَا ج ٧ ص ٢٠٤ حدیث ٣٢٥)

સાત મ-દની ફૂલોં કા “ફારૂકી ગુલદસ્તા”

અમીરુલ મુઅમિનીન, ઈમામુલ આદિલીન, મુતમ્મિમુલ અર-બઈન હઝરતે સય્યિદુના ઉમર ફારૂકે આ’ઝમ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ફરમાતે હૈં : ❀ ફુઝૂલ ગોઈ સે બચને વાલે કો હિક્મત વ દાનાઈ અતા કી જાતી હૈ ❀ ફુઝૂલ નિગાહી યા’ની બિલા ઝરૂરત ઇધર ઉધર દેખને સે બચને વાલે કો ખુશૂએ કલબ (સુકૂને કલબી) ❀ ફુઝૂલ તઆમ (યા’ની ડટ કર ખાના યા બિગૈર કિસી ભૂક કે સિર્ફ લઝ્ઝત કે લિયે તરહ તરહ કી ચીઝેં ખાના) છોડને વાલે કો ઇબાદત મેં લઝ્ઝત દી જાતી હૈ ❀ ફુઝૂલ હંસને સે બચને વાલે કો રો’બ વ દબદબા ઇનાયત હોતા હૈ ❀ મઝાક મસ્ખરી સે બચને વાલે કો નૂરે ઈમાન નસીબ હોતા હૈ ❀ દુન્યા કી મહબ્બત સે બચને વાલે કો આખિરત કી મહબ્બત દી જાતી હૈ ❀ દૂસરોં કે ઐબ ઢૂંડને સે બચને વાલે કો અપને ઐબોં કી ઇસ્લાહ કી તૌફીક મિલતી હૈ.

(ماخوذًا من المنبهات ص ٨٩)

કરમાને મુસ્તફા صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم : જો શપ્સ મુઝ પર દુરુદ પાક પઢના ભૂલ ગયા વોહ જન્નત કા રોસ્તા ભૂલ ગયા. (طبرانی)

ઐ કાશ ! ઐસા હો જાએ.....

હર ઈસ્લામી ભાઈ ઔર ઈસ્લામી બહન હર મ-દની માહ કે પહલે પીર શરીફ કો ઈસ રિસાલે કે મુતા-લએ કા મા'મૂલ બના લે, **اِنَّ شَاءَ اللّٰهُ عَزَّوَجَلَّ** અપને કલ્બ મેં હૈરત અંગેઝ તબ્દીલી મહસૂસ ફરમાએંગે. મ-દની ઈન્આમ નમ્બર 45 ઔર 46 કે મુતાબિક અમલ ઝબાન કી હિફાઝત કા બેહતરીન ઝરીઆ હૈ લિહાઝા ફુઝૂલ ગોઈ સે બચને કી આદત ડાલને કે લિયે ઝરૂરી ગુફ્ત-ગૂ ભી કમ લફ્ઝોં મેં નિમટાએ નીઝ કુછ ન કુછ બાત ઈશારે સે ઔર લિખ કર કરને કી કોશિશ કીજિયે ઔર ફુઝૂલ બાત મુંહ સે નિકલ જાને કી સૂરત મેં ફૌરન એક યા તીન બાર દુરુદ શરીફ પઢને કા મા'મૂલ બના લીજિયે.

એક સહાબી કે જન્નતી હોને કા રાઝ

હમારે મીઠે મીઠે આકા મક્કી મ-દની મુસ્તફા صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم કી અતા સે લોગોં કો દેખ કર હી પહયાન લેતે થે કે યેહ જન્નતી હૈ યા જહન્નમી બલ્કે આને વાલે કી પહલે હી સે ખબર હો જાતી કે વોહ જન્નતી હૈ યા દોઝખી, યુનાન્યે અલ્લાહ **عَزَّوَجَلَّ** કે મહબૂબ, દાનાએ ગુયૂબ **صَلَّى اللّٰهُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم** ને ઈર્શાદ ફરમાયા : “જો શપ્સ સબ સે પહલે ઈસ દરવાઝે સે દાખિલ હોગા વોહ જન્નતી હોગા.” ઈતને મેં હઝરતે સચ્ચિદુના અબ્દુલ્લાહ બિન સલામ **رَضِيَ اللّٰهُ تَعَالٰی عَنْہُ** દરવાઝે સે દાખિલ હુએ, લોગોં ને ઉન કો મુબારક બાદ દેતે હુએ દરયાફત ક્રિયા કે આખિર કિસ અમલ કે સબબ આપ કો યેહ સઆદત મિલી ? સચ્ચિદુના અબ્દુલ્લાહ બિન સલામ **رَضِيَ اللّٰهُ تَعَالٰی عَنْہُ** ને ફરમાયા : મેરા અમલ બહુત હી થોડા હૈ, ઔર જિસ કી મેં અલ્લાહ **عَزَّوَجَلَّ** સે ઉમ્મીદ રખતા હૂં વોહ મેરે

કરમાને મુસ્તફા ઇબ્રાહીમ ઓળખાવવાનો છે : जिस के पास मेरा जिक्र हुआ और उस ने मुझ पर दुर्दे पाक न पड़ा तककीक वोह
बदअपत्त हो गया. (उरु)

સીને કી સલામતી ઓર બે મક્સદ ખાતોં કો છોડના હૈ.

(الصَّغْت لَابْنِ أَبِي الدُّنْيَا ج ٧ ص ٨٦ رقم ١١١)

ઈસ હદીસે પાક કે અલ્લાહ “سَلَامَةُ الصُّدْر” યા’ની “સીને કી સલામતી” સે મુરાદ દિલ કા લગ્વિયાત (યા’ની બેહૂદા) ઓર હસદ વગૈરા અમરાઝે ખાતિનિયા સે પાક હોના ઓર દિલ મેં ઈમાન કા મઝબૂત વ મુસ્દ્કમ હોના હૈ.

रफ़्तार का गुफ़्तार का किरदार का टे टे

હર ઉઝ્વ કા ટે મુઝ કો ખુદા કુફ્લે મદીના

(વસાઈલે બખ્શિશ, સ. 66)

صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلَّى اللهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

કુઝૂલ ખાતોં કી મિસાલેં

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! “કુઝૂલ ખાતેં” અગર્યે ગુનાહ નહીં તાહમ ઈસ મેં કોઈ ભલાઈ ભી નહીં. سُبْحَانَ اللَّهِ ! હઝરતે સય્યિદુના અબ્દુલ્લાહ બિન સલામ رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ કો ઝખાને રિસાલત સે દુન્યા હી મેં જન્નત કી બિશારત ઈનાયત હો ગઈ ! આપ رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ મેં એક ખૂબી યેહ ભી થી કે કભી કુઝૂલ ખાતોં મેં નહીં પડતે થે, જિસ કામ સે વાસિતા ન હોતા ઉસ કે બારે મેં પૂછતે તક નહીં થે, લેકિન અફ્સોસ ! હમારા જિન મુઆ-મલાત સે દૂર કા ભી તઅલ્લુક નહીં હોતા ફિર ભી ઉસ કે મુ-તઅલ્લિક બે જા સુવાલાત કરતે હી રહતે હૈં. મ-સલન ❀ યેહ કિતને મેં લિયા ? વોહ કિતને મેં મિલા ? કુલાં જગહ પ્લોટ કા ક્યા ભાવ ચલ રહા હૈ ? ❀ કિસી કે મકાન મેં ગએ યા કિસી ને નયા મકાન લિયા તો સુવાલ હોતા હૈ : કિતને કા લિયા ? કિતને કમરે હૈં ? કિરાયા કિતના હૈ ?

करमाने मुस्तका على الله تعالى عليه وآله وسلم : जिस ने मुज पर दस भरतबा सुब्द और दस भरतबा शाम दुइद पाक पढा
उसे डियामत के दिन मेरी शक्रात मिलेगी. (दा.अ.अ.)

मकान मालिक कैसा है ? (येह सुवाल अक्सर **الله** गीबत व तोहमत का दरवाजा फोलने का सबभ बन जाता है क्यूंके इस का जवाब उमूमन बिला एंजाजते शर-ए कुछ इस तरह गुनाहों बरा मिलता है : हमारा मकान मालिक बहुत सप्त मिजाज/ बे रहम/ टेढा/ फोयडा/ भर द्दिमाग/ वायडा/ कन्जूस है) वगैरा वगैरा ❀ एंसी तरह जब कोई नई दुकान, कार, या स्कूटर वगैरा ખरीदे तो बिला वजह ખरीदने वाले से उस का भाव, पाखेदारी, नकद, उधार, किस्तों वगैरा से मु-तअद्विक सुवालात किये जाते हैं ❀ बेयारा मरीज जिस से बोला तक नहीं जाता है उस से भी भा'ज एंयादत करने वाले नादान एंन्सान जैसे “डोक्टरों के भी डोक्टर” न हों यूं पूरा पूरा हिसाब लेते और सब तइसीलात मा'लूम करते हैं यहां तक के अक्सरे और लेबोरेटरी की कारकईगी भी वुसूल करते हैं और अगर ऑपरेशन हुवा हो तो बिला वजह सुवालात के जरीअे टांकों की ता'दाद तक पूछ लेते हैं, उता के “शर्म की जगह” का मअ्वला हो तब भी भा'ज बे शर्म उस का तइसीली अेहतिसाब करते हुअे नहीं शरमाते. इस तरह की हुजूलिय्यात में औरतें भी मर्दों से किसी तरह पीछे नहीं रहतीं ❀ गरमी या सर्दी के मौसिम में इस की कभी जियादती के मौकअ पर बिला हाजत भातें होती हैं म-सलन गरमी के मौसिम में भा'ज अबुल हुजूल “उई ! उई” करते हुअे कहेंगे : अेक तो आज कल सप्त गरमी है और ओपर से बिजली भी बार बार चली जाती है ❀ एंसी तरह सर्दियों में अदाकारी के साथ दांत बजाते हुअे कहेंगे : आज तो बहुत कडाके की सर्दी है ❀ अगर बारिश का मौसिम है तो बिला जइरत इस पर भी तब्सिरा किया जाता है म-सलन आज कल तो बारिशें बहुत

કરમાને મુસ્તફા صلى الله تعالى عليه وآله وسلم : जिस के पास मेरा जिक्र हुवा और उस ने मुझ पर दुइद शरीक न पढा उस ने जइका की. (जिज्ज)

હો રહી હૈં, હર તરફ પાની ખડા હો ગયા હૈ, ઈન્તિઝામિયા કીચડ સાફ કરવાને કા કોઈ ખયાલ નહીં કરતી વગૈરા વગૈરા ❀ ઈસી તરહ મુલ્કી ઓર સિયાસી હાલાત પર બિલા નિચ્ચતે ઈસ્લાહ બે જા તબ્સિરે, મુખ્તલિફ સિયાસી પાર્ટિયોં પર બિલા વજહ તન્કીદેં ❀ કિસી શહર યા મુલ્ક કા સફર કિયા હૈ તો વહાં કે પહાડોં ઓર સબ્જા ઝારોં કી ગૈર ઝરૂરી મન્ઝર કશી, મકાનોં ઓર સડકોં કી તફસીલાત કા બિલા ઝરૂરત બયાન વગૈરા વગૈરા યેહ સબ ફુઝૂલ ગોઈ નહીં તો ઓર ક્યા હૈ ? અલબત્તા યેહ યાદ રહે કે મઝકૂરા બાલા ઉમૂર કે બારે મેં અગર હમ કિસી કો બાતેં કરતા હુવા પાએં તો અપને આપ કો બદ ગુમાની સે બચાએં ક્યુંકે બા'ઝ અવકાત ઝાહિરી દુન્યવી બાતેં ભી અચ્છી નિચ્ચત કે બાઈસ કારે સવાબ હો જાતી હૈં યા કમ અઝ કમ ફુઝૂલિચ્ચાત મેં નહીં રહતીં.

ફુઝૂલ ગો કા ઝૂટે મુબા-લગે કે ગુનાહ સે બચના દુશ્વાર હોતા હૈ

યેહ ઝેહન મેં રહે કે ફુઝૂલ બોલના ગુનાહ નહીં મગર ફુઝૂલ ગોઈ સિફ ઉસ વક્ત હૈ જબકે બિલા કમ વ કાસ્ત ઓર સહીહ સહીહ બયાન કરે, અગર ઝૂટે મુબા-લગે કિયે તો ગુનાહોં કી ખાઈ મેં જા ગિરા ! તશ્વીશ કી બાત યેહ હૈ કે ઈસ તરહ કી ગુફ્ત-ગૂ કો નાપ તોલ કર દુરુસ્ત બયાન કરના કે “ફુઝૂલ ગોઈ” કી હદ સે આગે ન બઢે યેહ બહુત મુશ્કિલ અમ્ર હોતા હૈ, અક્સર ઝૂટે મુબા-લગે હો હી જાતે હૈં, ફુઝૂલ ગો બારહા ગીબતોં, તોહ્મતોં, ઐબ દરિયોં ઓર દિલ આઝારિયોં વગૈરા કે દલદલ મેં ભી જા પડતા હૈ. લિહાઝા આફિચ્ચત યુપ રહને હી મેં હૈ કે એક યુપ સો¹⁰⁰ સુખ.

કાશ ! બોલને સે કબ્લ ઝરા ઠહર કર તોલને કી સઆદત મિલ જાએ વાકેઈ અગર કોઈ ઈન્સાન બોલને સે કબ્લ “તોલને” યા'ની ગૈર

કરમાને મુસ્તફા صلى الله تعالى عليه واله وسلم : જો મુઝ પર રોઝે જુમુઆ દુરૂદ શરીફ પઢેગા મેં કિયામત કે દિન ઉસ કી શકાઅત કરુંગા. (ક્રમીલ)

કરને કી આદત ડાલે તો ઉસે અપની બે શુમાર ફુઝૂલ ખાતેં ખુદ હી મહસૂસ હોની શુરૂઅ હો જાએં ! સિફ “ફુઝૂલ ખાતેં” હોં તો અગર્યે ગુનાહ નહીં મગર કઈ તરહ કે નુક્સાનાત ઈન મેં મૌજૂદ હેં મ-સલન ઈન ખાતોં મેં ઝબાન ચલાને કી ઝહમત હોતી ઔર કીમતી વક્ત બરબાદ હોતા હૈ અગર ઉતની દેર ઝિકુલ્લાહ યા દીની મુતા-લઆ કર લિયા જાએ, યા કોઈ સુન્નત બયાન કર દી જાએ તો સવાબ કા અમ્બાર લગ જાએ.

દહ્શત ગર્દિયોં કે ફુઝૂલ તઝકિરે

ઈસી તરહ ﷻ કહીં દહ્શત ગર્દી કી વારિદાત હો ગઈ તો બસ લોગોં કો ફુઝૂલ બલકે બા’ઝ સૂરતોં મેં ગુનાહોં ભરી બહસ કે લિયે એક મૌજૂઅ હી હાથ આ ગયા ! હર જગહ ઉસી કા તઝકિરા, બે સર વ પા કિયાસ આરાઈયાં, બે તુકે તબ્સિરે, અટકલ સે કિસી ભી પાર્ટી યા લીડર વગૈરા પર તોહમત લગા દેના વગૈરા. અક્સર યેહ ગુફ્ત-ગૂ “ફુઝૂલ” હી નહીં, લોગોં મેં ખૌફો હિરાસ ફેલને કા બાઈસ, અફવાહેં ગર્મ હોને કા સબબ ઔર હંગામે બરપા હોને કી “વજહ” ભી બનતી હેં, ધમાકોં ઔર દહ્શત ગર્દિયોં કી વારિદાતેં સુનને સુનાને મેં નફ્સ કો બે ઈન્તિહા દિલચસ્પી હોતી હૈ, બસા અવકાત લબ પર દુઆઈયા અલ્લાઝ હોતે હેં મગર કલબ કી ગહરાઈયોં મેં સન્સની ખૈઝ ખબરેં સુનને સુનાને કે ઝરીએ હઝ (યા’ની મઝે) ઉઠાને ઔર લુલ્હ અન્દોઝ હોને કા જઝબા છુપા હોતા હૈ, કાશ ! નફ્સ કી ઈસ શરારત કો પહચાનતે હુએ હમ દહ્શત ગર્દિયોં ઔર ધમાકોં કે તઝકિરોં મેં દિલચસ્પી લેને સે બાઝ આ જાએં. હાં મઝલૂમાના શહાદત પાને વાલોં, ઝખ્મિયોં ઔર મુ-તઅસ્સિરા મુસલમાનોં કી હમ-દર્દિયોં, ખિદમતોં ઔર અમ્ન વ સલામતી કી દુઆઓં સે ગુરેઝ

કરમાને મુસ્તકા : طَلَى اللّٰهُ تَعَالَى عَلَيْهِ وَالْوَالِدِينَ وَسَلَّمَ : મુઝ પર દુરુદે પાક કી કસરત કરો બેશક યેહ તુમહારે લિયે તહારત હૈ. (મુસ્લિમ)

ન કિયા જાએ કે યેહ સવાબ કે કામ હૈં. બસ જબ ભી ઈસ તરહ કી ગુફત-ગૂ કરને સુનને કી સૂરત પૈદા હો તો અપને દિલ પર ગૌર કર લેના યાહિયે કે નિચ્ચત ક્યા હૈ ? અગર અચ્છી નિચ્ચત પાએં તો ઉમ્દા ઔર બહુત ઉમ્દા હૈ મગર અક્સર ઈસ કિસ્મ કી ગુફત-ગૂ કા હાસિલ “સન્સની” સે લુત્ફ અન્દોઝી હી પાયા જાતા હૈ.

સિદીકે અકબર મુંહ મેં પથ્થર રખ લેતે

યાદ રખિયે ! ઝબાન ભી અલ્લાહ ﷻ કી અઝીમ ને’મત હૈ, ઈસ કે બારે મેં ભી કિયામત કે રોઝ સુવાલ હોના હૈ, લિહાઝા ઈસ કા હરગિઝ બે જા ઈસ્તિ’માલ ન કિયા જાએ. સચ્ચિદુના સિદીકે અકબર رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ કલ્ઈ જન્નતી હોને કે બા લુજૂદ ઝબાન કી આફતોં સે બેહદ મોહતાત રહા કરતે થે યુનાન્ચે “એહયાઉલ ઉલૂમ” મેં હૈ : હઝરતે સચ્ચિદુના અબૂ બક સિદીક رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ અપને મુબારક મુંહ મેં પથ્થર રખ લિયા કરતે થે તા કે બાત કરને કા મૌકઅ હી ન રહે.

(احياء العلوم ૩ ص ૧૩૧)

રખ લેતે થે પથ્થર સુન અબૂ બક દહન મેં

ઐ ભાઈ ! ઝબાં પર તૂ લગા કુફલે મદીના

(વસાઇલે બખ્શિશ, સ. 66)

صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلَّى اللهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

40 બરસ તક ખામોશી કી મશક

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! અગર આપ વાકેઈ ખામોશી કી આદત બનાના યાહતે હૈં તો ઈસ પર સન્જી-દગી સે ગૌર કરના હોગા, ઔર ખૂબ મશક કરની પડેગી વરના સર-સરી કોશિશ સે

ફરમાને મુસ્તફા ﷺ : طمى الله تعالى عليه وآله وسلم : तुम जहाँ भी हो मुज पर दुरुद पढो के तुम्हारा दुरुद मुज तक पधोयता है. (طبرانی)

ઝબાન પર કુફૂલે મઢીના લગના દુશ્વાર હૈ. ઝબાન કે બે જા ઈસ્તિ'માલ કી તબાહ કારિયોં સે ખુદ કો ડરાતે હુએ ખામોશી કી આદત બનાને કી ભરપૂર સઅ્ય ફરમાઈયે إِنَّ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ કામ્યાબી આપ કે કદમ ચૂમેગી. મગર કોશિશ ઈસ્તિકામત કે સાથ હોની ચાહિયે. આઈયે ! એક કોશિશ કરને વાલે કી ઈસ્તિકામત કી હિકાયત સુનતે હૈં, હઝરતે સચ્ચિદુના અરતાહ બિન મુન્જિર عَلَيْهِ وَسَلَّمَ ફરમાતે હૈં : એક શાખ્સ ચાલીસ સાલ તક ખામોશ રહને કી ઈસ તરહ “મશ્ક” કરતા રહા કે અપને મુંહ મેં પથ્થર રખતા, યહાં તક કે ખાને યા પીને યા સોને કે ઈલાવા વોહ પથ્થર મુંહ સે ન નિકાલતા.

(الصَّغْتِ لِأَيِّ النَّبِيَّاتِ ٧ ص ٢٠٦ رقم ٤٣٨) યાદ રહે ! પથ્થર ઈતના છોટા ન હો કે હલ્ક સે નીચે ઉતર કર કિસી બડી મુશ્કિલ મેં ડાલ દે નીઝ રોઝે કી હાલત મેં મુંહ મેં પથ્થર ન રખા જાએ કે ઈસ કી મિટ્ટી વગૈરા હલ્ક મેં જા સકતી હૈ.

ગુફ્ત-ગૂ લિખ કર મુહા-સબા કરને વાલે તાબેઈ બુમુગ

હઝરતે સચ્ચિદુના રબીઅ બિન ખુસૈમ عَلَيْهِ وَسَلَّمَ ને બીસ સાલ તક દુન્યાવી બાત ઝબાન સે નહીં કી, જબ સુબહ હોતી તો કલમ દવાત ઓર કાગઝ લે લેતે ઓર દિન ભર જો બોલતે ઉસે લિખ લેતે ઓર શામ કો ((સ લિખે હુએ કે મુતાબિક) અપના મુહા-સબા ફરમાતે.

(حياة العلوم ج ٣ ص ١٣٧)

બાતચીત કે મુહા-સબે કા તરીકા

અપના “મુહા-સબા” કરને સે મુરાદ યહાં યેહ હૈ કે અપની હર હર બાત પર ગૌર કર કે અપને આપ સે બાઝપુર્સ કરના મ-સલન ફુલાં બાત ક્યૂં કી ? ઉસ મકામ પર બોલને કી ક્યા હાજત થી ?

ફરમાને મુસ્તફા ﷺ : जिस के पास मेरा जिक्र हो और वोह मुझ पर दुर्इद शरीक न पड़े तो वोह लोगों में से कजूस तरीन शरूस है. (रुह)।

કુલાં ગુફત-ગૂ ઇતને અલ્ફાઝ મેં ભી નિમટાઈ જા સકતી થી મગર ઇસ મેં કુલાં કુલાં લફઝ ઝાઈદ ક્યૂં બોલે ? કુલાં સે જો જુમ્લા તુમ ને કહા વોહ શર-ઈ ઇજાઝત સે ન થા બલ્કે દિલ આઝાર તન્ઝ થા, ઉસ કા દિલ દુખા હોગા અબ ચલો તૌબા ભી કરો ઔર ઉસ ઇસ્લામી ભાઈ સે મુઆફી ભી માંગો, ઉસ બૈઠક મેં ક્યૂં ગએ જબ કે મા'લૂમ હૈ કે વહાં ફુઝૂલ બાતેં ભી હોતી હૈં ઔર કુલાં કુલાં બાત મેં તુમ ને હાં મેં હાં ક્યૂં મિલાઈ થી ? વહાં તુમ્હેં ગીબત ભી સુનની પડ ગઈ થી બલ્કે તુમ ને ગીબત સુનને મેં દિલચસ્પી ભી લી થી ચલો પક્કી તૌબા ઔર ઐસી બૈઠકોં સે દૂર રહને કા ભી અહ્દ કરો. ઇસ તરહ સમઝદાર આદમી અપની ગુફત-ગૂ બલ્કે રોઝ મર્રા કે જુમ્લા મુઆ-મલાત કા મુહા-સબા કર સકતા હૈ. યૂં ગુનાહ, બે એહતિયાતિયાં, અપની બહુત સારી કમઝોરિયાં ઔર ખામિયાં સામને આ સકર્તી ઔર ઇસ્લાહ કા સામાન હો સકતા હૈ. દા'વતે ઇસ્લામી કે મ-દની માહોલ મેં મુહા-સબે કો ફિકે મદીના કહતે હૈં ઔર દા'વતે ઇસ્લામી મેં રોઝાના કમ અઝ કમ 12 મિનટ ફિકે મદીના કરને ઔર ઇસ દૌરાન મ-દની ઇ-આમાત કા રિસાલા પુર કરને કા ઝેહન દિયા જાતા હૈ.

जिको दुर्इद डर घडी विहँ जभां रहै

मेरी कुजूल गोई की आदत निकाल दो

(वसाईले बख्शिश, स. 164)

صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلَّى اللهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

ઉમર બિન અબ્દુલ અઝીઝ ફૂટ ફૂટ કર રોએ

હઝરતે સય્યિદુના અબૂ અબ્દુલ્લાહ ﷺ ફરમાતે હૈં કે

ફરમાને મુસ્તફા ﷺ : عَلَى اللَّهِ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : उस शपथ की नाक भाक आवूँद हो जिस के पास मेरा जिक्र हो और वोह मुज पर दुवरे पाक न पड़े. (१७)

मैं ने सुना के अेक आलिम साहिब हजरते सय्यिदुना उमर बिन अब्दुल अजीज رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ के सामने कहने लगे : “खामोश आलिम” भी बोलने वाले आलिम ही की तरह होता है. इरमाया : मैं समजता हूँ के बोलने वाला क्रियामत के दिन युप रहने वाले आलिम से अइजल होगा इस लिये के बोलने वाले का नइअ लोगों को पड़ोयता है जबके युप रहने वाले को सिई जाती इअेदा मिलता है. वोह आलिम साहिब बोले : “या अमीरुल मुअमिनीन ! क्या आप बोलने के इितनों से ना वाकिफ हें ?” हजरते सय्यिदुना उमर बिन अब्दुल अजीज رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ येह सुन कर शदीद (या’नी इूट इूट कर) रोअे. (۱۶۸رقم۳۴۰ص۷الأنبياء) अद्लाह عَزَّ وَجَلَّ की उन पर रहमत हो और उन के सदके हमारी बे हिसाब मइरत हो.

اميين بجاهِ النَّبِيِّ الْأَمِينِ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ

हिकायत की वजाहत

भीठे भीठे इस्लामी भाईयो ! हमारे बुजुर्गों की अेहतियातें और जज्बअे षौई षुदा मरहबा ! अलबत्ता इस बात में कोई शक नहीं के मोहतात उ-लमाअे दीन का वा’ज व नसीहत इरमाना, शर-ई अहकाम बताना, मुबल्लिगीन का सुन्नतों त्तरा बयान करना, नेकी की दा’वत देना, खामोशी के मुकाबले में अइजल तरीन अमल है. मगर उन आलिम साहिब का सय्यिदुना उमर बिन अब्दुल अजीज رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ की बारगाह में बतौर तम्भीह येह अर्ज करना के “क्या आप बोलने के इितनों से ना वाकिफ हें ?” अपनी जगह दुरुस्त था और अमीरुल मुअमिनीन رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ का षौई षुदा से जारो कितार रोना भी उन आलिमे रब्बानी के इस इिकरे की तह तक पड़ोयने की वजह से था. वाकेई अख्श

કરમાને મુસ્તફા علی الله تعالى علیه وسلم : जिस ने मुज पर रोजे जुमुआ दो सो बार दुइटे पाक पढा उस के दो सो साल के गुनाह मुआफ़ होंगे. (अमर)

બોલના અગર્યે મખ્લૂક કે લિયે નફ્અ બખ્શ હૈ લેકિન ખુદ બોલને વાલે કે લિયે ઈસ મેં કઈ ફસાદાત કે ખતરાત ભી મૌજૂદ હેં મ-સલન અગર અચ્છા મુબલ્લિગ હૈ તો અપની ફસાદત વ બલાગત ઔર ગુફ્ત-ગૂ કી રવાની પર દૂસરોં કી તરફ સે મિલને વાલી દાદો તહ્સીન કે સબબ યા સિર્ફ અપની સલાહિય્યત પર ઘમન્ડ કે બાઈસ યા અપને આપ કો “કુછ” સમઝને ઔર દૂસરોં કો હકીર જાનને યા સિર્ફ નફ્સાનિય્યત કી વજહ સે દૂસરોં પર ધાક બિઠાને ઔર અપની વાહ વાહ કરવાને કી ખાતિર ખૂબ મુહા-વરાત વ ઉમ્દા ફિકરાત વગૈરા કી તરકીબેં કરતે રહને નીઝ ઈસ કે લિયે અદક યા’ની મુશ્કિલ યા ખૂબ સૂરત અલ્ફાઝ બોલને વગૈરા વગૈરા કે ફિતનોં મેં પડ સકતા હૈ. અગર અ-રબી બોલયાલ પર ઉબૂર હુવા તો ખાત વ બયાનાત મેં અપની અ-રબી દાની કા સિક્કા જમાને કી ખાતિર ખૂબ અ-રબી મકૂલોં વગૈરા કે ઈસ્તિ’માલ કે ફિતને મેં મુબ્તલા હો સકતા હૈ, ઈસી તરહ જિસ કી આવાઝ અચ્છી હો વોહ ભી ખતરોં મેં ઘિરા રહતા હૈ, ચૂંકે લોગ અકસર ઐસોં કી તા’રીફ કરતે હેં જિસ પર “ફૂલ” કર ઉસ કે મગરૂર હો જાને, અચ્છી આવાઝ કો અતિય્યએ ખુદા વન્દી (યા’ની અલ્લાહ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ કી અતા) સમઝને કે બજાએ અપના કમાલ સમઝ બૈઠને વગૈરા ગ-લતિય્યોં કા ખદશા રહતા હૈ. તો ઉન આલિમે રબ્બાની કી “બોલને” કે મુ-તઅલ્લિક તમ્બીહ બજા હૈ ઔર વાકેઈ જો મુબલ્લિગ મઝકૂરા મઝમૂમ સિફાત રખતા હો ઉસ કા બોલના ઉસ કે અપને હક મેં બહુત બડા ફિતના ઔર બરબાદિયે આખિરત કા સામાન હૈ અગર્યે મખ્લૂક કો ઉસ સે નફ્અ પહોંચતા હો.

ખાત કો ફુઝૂલિય્યાત સે પાક કરને કા બેહતરીન ગુસ્ખા

અપની ગુફ્ત-ગૂ મેં કમી લાને કે જો વાકેઈ ખ્વાહિશ મન્દ હેં ઉન

﴿فَرِحْنَا بِكُم كَمَا فَرِحَ بِكُمُ الْمَلَأُ مِنَ الْأَحْزَابِ﴾ : मुज पर दुइद शरीक पढो अल्लाह कळ तुम पर रहमत भेजेगा. (अनसरी)

के लिये अपनी बात की तन्कीह (या'नी छानबीन) करने और अपनी गुफ्त-गू को भे जा या जइरत से जाईद लइजों और मुफ्तलिइफ आमियों से पाक करने नीज नुक्सान देह बलके कुजूलिय्यात की आमैजिश से बयाने के लिये “अहयाउल उलूम” से अक बेहतरीन नुस्खा पेश किया जाता है युनान्ये हुजुतुल ईस्लाम हजरते सय्यिहुना ईमाम मुहम्मद बिन मुहम्मद बिन मुहम्मद गजाली عَلَيْهِ رَحْمَةُ اللَّهِ الْوَالِيَّةُ के इरमाने वाला शान का फुलासा है : गुफ्त-गू की चार किस्में हैं : **﴿1﴾** मुकम्मल नुक्सान देह बात **﴿2﴾** मुकम्मल झाअदे मन्द बात **﴿3﴾** औसी बात जो नुक्सान देह ली हो और झाअदे मन्द ली. और **﴿4﴾** औसी बात जिस में न झाअदे हो न नुक्सान. पस पहली किस्म की बात जो के मुकम्मल नुक्सान देह है उस से हमेशा परहेज जइरी है. और ईसी तरह तीसरी किस्म वाली बात के जिस में नुक्सान और झाअदे दोनों हैं, ईस से ली बयाना लाजिम है. और जो चौथी किस्म है वोह कुजूलिय्यात में शामिल है के उस का न कोई झाअदे है और न ही कोई नुक्सान लिहाजा औसी बात में वक्त जाअेअ करना ली अक तरह का नुक्सान ही है. ईस के बा'द सिई दूसरी ही किस्म की बात रह जाती है या'नी बातों में से तीन चौथाई (या'नी 75%) तो काबिले ईस्ति'माल नहीं और सिई अक चौथाई (या'नी 25%) बात जो के झाअदे मन्द है अस वोही काबिले ईस्ति'माल है मगर ईस काबिले ईस्ति'माल बात के अन्दर बारीक किस्म की रियाकारी, बनावट, गीबत, जूटे मुबा-लगे “मैं मैं करने की आइत” या'नी अपनी इजीलत व पाकीजगी बयान कर बैठने वगैरा वगैरा अन्देशे हैं नीज झाअदे मन्द गुफ्त-गू करते करते कुजूल बातों में जा पडने फिर उस के जरीअे मजीद आगे बढ़ते

ਕਰਮਾਨੇ ਮੁਸਤਫ਼ਾ ﷺ : مُؤْجٍ پَر كَسْرَت سَے دُرُؤْدَے پَاك پَدّو بَہْشَك تُوْمَدَارَا مُؤْجٍ پَر دُرُؤْدَے پَاك پَدّਨَا
 تُوْمَدَارَے گُوْنَاہُوں كَے لِیَہِے مَہْكَرِیْت ہِے. (۲۶۶)

હુએ ઈસ મેં ગુનાહ કા ઈરતિકાબ હો જાને વગૈરા વગૈરા ખદશાત
 શામિલ હેં ઔર યેહ શુમૂલિયત ઐસી બારીક હૈ જિસ કા ઈલ્મ નહી
 હોતા, લિહાઝા ઈસ કાબિલે ઈસ્તિ'માલ બાત કે ઝરીએ ભી ઈન્સાન
 ખતરાત મેં ઘિરા રહતા હૈ. (مُلَخَّصٌ اَزْاَحْيَاءِ اَلْعُلُوْمِ ج ۳ ص ۱۳۸)

युप रहने में सो सुप हैं तू येह तजरिबा कर ले
 औ भाई! ज्हां पर तू लगा कुझ्ले मदीना

(वसाईले अफ़िशिश, स. 66)

બે વુકૂફ બે સોયે બોલતા હે

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! અકલ મન્દ પહલે બાત કો
 તોલતા હૈ ફિર મુંહ સે બોલતા હૈ ઔર બે વુકૂફ જો કુછ જી મેં આએ
 બોલતા ચલા જાતા હૈ, યાહે ઈસ કી વજહ સે કિતના હી ઝલીલ ક્યું
 ન હોના પડે. યુનાન્યે હઝરતે સય્યિદુના હસન બસરી عَلَيْهِ رَحْمَةُ اللهِ الْقَوِي
 ફરમાતે હેં : લોગોં મેં મશહૂર થા કે અકલ મન્દ કી ઝબાન ઉસ કે દિલ
 કે પીછે હોતી હૈ વોહ બાત કરને સે પહલે અપને દિલ સે રુજૂઅ
 કરતા હૈ યા'ની ગૌર કરતા હૈ કે કહૂં યા ન કહૂં ? અગર મુફીદ હોતી
 હૈ તો કહતા હૈ વરના યુપ રહતા હૈ. જબકે બે વુકૂફ કી ઝબાન ઉસ કે
 દિલ કે આગે હોતી હૈ કે ઈધર યા'ની દિલ કી તરફ રુજૂઅ કરને કી
 નૌબત હી નહીં આતી બસ જો કુછ ઝબાન પર આયા કહ દેતા હૈ.

(مُلَخَّصٌ اَزْتَنْبِيْهٍ اَلْغَاظِلِيْنَ ص ۱۱۰)

બોલને સે પહલે તોલને કા તરીકા

પ્યારે ઈસ્લામી ભાઈયો ! યાદ રખિયે ! હમારે મીઠે મીઠે
 આકા મક્કી મ-દની મુસતફા ﷺ ને કભી ભી

ફરમાને મુસ્તકા علی اللہ تعالیٰ علیه و آله وسلم : જો મુઝ પર એક દુરૂદ શરીફ પઠતા હે અલ્લાહ જુઝુઝ ઉસ કે લિયે એક કીરાત અજર લિખતા હૈ ઓર કીરાત ઉહુદ પહાડ જિતના હૈ. (Jihad)

અપની ઝબાને હક્કે તરજુમાન સે કોઈ ફાલતૂ લફઝ અદા નહીં ફરમાયા ઓર ન હી કભી કહ્કહા લગાયા. કાશ ! યેહ ખામોશી ઓર ઝોર સે ન હંસને કી સુન્નતે ભી આમ હો જાએ. ઐ કાશ ! હમ “બોલને” સે પહલે “તોલને” કે આદી બન જાએ. તોલને કા તરીકા યેહ હૈ કે ઈસ સે પહલે કે અલ્ફાઝ ઝબાન સે અદા હોં અપને દિલ સે સુવાલ કર લિયા જાએ કે ઈસ બોલને કા મક્સદ ક્યા હૈ ? ક્યા મેં કિસી કો નેકી કી દા’વત દે રહા હૂં ? ક્યા યેહ બાત જો મેં બોલના ચાહતા હૂં ઈસ મેં મેરા યા કિસી દૂસરે કા ભલા હૈ ? મેરી બાત કહીં ઐસે મુબા-લગે સે પુર તો નહીં જો મુઝે ઝૂટ કે ગુનાહ મેં મુબતલા કર દે. ઝૂટે મુબા-લગે કી મિસાલ દેતે હુએ સદરુશરીઅહ, બદરુતરીકહ હઝરતે અલ્લામા મૌલાના મુફ્તી મુહમ્મદ અમજદ અલી આ’ઝમી رَحْمَةُ اللهِ الْقَوِي ફરમાતે હેં : “અગર એક મર્તબા આયા ઓર યેહ કહ દિયા કે હઝાર મર્તબા આયા તો ઝૂટા હૈ.” (બહારે શરીઅત, જિ. 3, સ. 519) યેહ ભી સોચે કે મેં કહીં કિસી કી ઝૂટી તા’રીફ તો નહીં કર રહા ? કિસી કી ગીબત તો નહીં હો રહી ? મેરી ઈસ બાત સે કિસી કા દિલ તો નહીં દુખ જાએગા ? બોલ કર નદામત કે સબબ રુજૂઅ કરને યા SORRY કહને કી નૌબત તો નહીં આએગી ? થૂક કર ચાટને યા’ની જોશ મેં કહી હુઈ બાત વાપસ તો નહીં લેની પડેગી ? કહીં અપના યા કિસી દૂસરે કા રાઝ ફાશ તો નહીં કર બૈઠૂંગા ? બોલને સે પહલે બાત કો તોલને મેં અગર યેહ બાત ભી સામને આઈ કે ઈસ બાત મેં ન નફ્અ હૈ ન નુક્સાન ઓર ન હી સવાબ હૈ ન ગુનાહ, તબ ભી યેહ બાત બોલ દેને મેં એક તરહ કા નુક્સાન હી હૈ ક્યૂંકે ઝબાન કો ઈસ તરહ કી ફુઝૂલ ઓર બે ફાએદા ગુફ્ત-ગૂ કે લિયે ઝહમત દેને કે બજાએ

ફરમાને મુસ્તકા : **صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ** : जिस ने क़िताब में मुज़ पर दुइइ पाक लिखा तो जब तक मेरा नाम उस में रहेगा फिरशते उस के लिये ईस्तिग़्कार करते रहेंगे. (१)

અગર કહ લિયા જાએ
યા દુરુદ શરીફ પઢ લિયા જાએ તો યકીનન ઈસ મેં ફાએદા હી ફાએદા
હે ઔર યેહ અપને અનમોલ વક્ત કા બેહતરીન ઈસ્તિ'માલ હૈ, એસે
અઝીમ ફાએદે કા ઝાએઅ હોના ભી લાઝિમન નુક્સાન હી હૈ.

ઝિકો દુરુદ હર ઘડી વિદેં જબાં રહે

મેરી ફુજૂલ ગોઈ કી આદત નિકાલ દો

(વસાઇલે બખ્શિશ, સ. 164)

ચુપ રહને કા તરીકા

પ્યારે ઈસ્લામી ભાઈયો ! ફુજૂલ ગોઈ ગુનાહ ન સહી મગર
ઈસ મેં મહરૂમિયાં ઔર કાફી નુક્સાનાત મૌજૂદ હેં લિહાઝા ઈસ સે
બચના બેહદ ઝરૂરી હૈ. કાશ ! કાશ ! એ કાશ ! ખામોશી કી આદત
ઝાલને કે લિયે ઝબાન પર “કુફલે મદીના” લગાને કી સઆદત મિલ
જાતી.

હિકાયત : હઝરતે સય્યિદુના મુવર્રિક ઈજલી **رَحْمَةُ اللهِ تَعَالَى عَلَيْهِ** ફરમાતે
હેં કે એક એસા મુઆ-મલા જિસે મેં 20 સાલ તક હાસિલ કરને કી
કોશિશ કરતા રહા લેકિન પા ન સકા મગર ફિર ભી ઉસ કી તલબ
નહીં છોડી. પૂછા ગયા : વોહ અહમ ચીઝ ક્યા હૈ ? ફરમાયા :
ખામોશ રહના. (۱۷۶۲ رقم ۳۱۰ لایلام أحمد ص) ખામોશી કે તલબ
ગાર કો ચાહિયે કે ઝબાન સે કરને કે બજાએ રોઝાના થોડી બહુત
બાતેં લિખ કર યા ઈશારે સે ભી કર લિયા કરે **إِنْ شَاءَ اللهُ عَزَّوَجَلَّ** ઈસ તરહ
ખામોશી કી આદત શુરૂઅ હો જાએગી. **الْحَمْدُ لِلَّهِ عَزَّوَجَلَّ** “દા’વતે
ઈસ્લામી” કી તરફ સે નેક બનને કે અઝીમ નુસ્ખે “મ-દની
ઈન્આમાત” કા એક મ-દની ઈન્આમ યેહ ભી હૈ : ક્યા આજ આપ

કરમાને મુસ્તકા علی اللہ تعالیٰ علیہ وسلم : जिस ने मुज पर ओक बार दुरदें पाक पढा अद्लाह कुज्ज उस पर दस रदमतें भेजता है. (म)

ને ઝબાન કા કુફૂલે મદીના લગાતે હુએ ફુઝૂલ ગોઈ સે બચને કી આદત ડાલને કે લિયે કુછ ન કુછ ઈશારે સે ઔર કમ અઝ કમ ચાર બાર લિખ કર ગુફૂત-ગૂ કી ? ખામોશી કી આદત બનાને કી કોશિશ કે દૌરાન ઐસા ભી હો સકતા હૈ કે ફુઝૂલ ગોઈ સે બચને કી કોશિશ મેં ચન્દ રોઝ કામ્યાબી મિલી મગર ફિર બોલને કી આદત હસ્બે મા'મૂલ હો જાએ, અગર ઐસા હો ભી તો હિમ્મત મત હારિયે, બાર બાર કોશિશ કીજિયે જઝબા સચ્ચા હુવા તો **كَمْ يَكْفُرُ الْإِنْسَانُ** કામ્યાબી ઝરૂર હાસિલ હોગી. ખામોશી કી આદત બનાને કી મશક કરને કે દૌરાન અપના ચેહરા મુસ્કરાતા રખના મુનાસિબ હૈ તા કે કિસી કો ચેહ ન લગે કે આપ ઉસ સે નારાઝ હેં જભી મુંહ “ફુલાયા” હુવા હૈ. ખામોશી કી કોશિશ કે દિનોં મેં ગુસ્સા બઢ સકતા હૈ લિહાઝા અગર કોઈ આપ કા ઈશારા ન સમઝ પાએ તો હરગિઝ ઉસ પર ગુસ્સે કા ઈઝહાર ન કીજિયે કે કહીં બે જા દિલ આઝારી વગૈરા કા ગુનાહ ન કર બૈઠેં. ઈશારે વગૈરા સે ગુફૂત-ગૂ સિર્ફ ઉન્હીં કે સાથ મુનાસિબ રહતી હૈ જિન કે સાથ આપ કી ઝેહની હમ આહંગી હો, અજનબી યા ના માનૂસ આદમી હો સકતા હૈ કે ઈશારે વગૈરા કી ગુફૂત-ગૂ કે સબબ આપ સે “નારાઝ” હો જાએ, લિહાઝા ઉસ કે સાથ ઝરૂરતન ઝબાન સે બાતચીત કર લીજિયે. બલ્કે કઈ સૂરતોં મેં ઝબાન સે બોલના વાજિબ ભી હો જાતા હૈ. મ-સલન મુલાકાતી કે સલામ કા જવાબ વગૈરા. કિસી સે મુલાકાત કે વક્ત સલામ ભી ઈશારે સે નહીં ઝબાન સે કરના સુન્નત હૈ. યૂં હી દરવાઝે પર કોઈ દસ્તક દે ઔર અન્દર સે પૂછા જાએ કૌન હૈ ? તો જવાબ મેં બાહર વાલા, “મદીના ! ખોલો”, “મેં હૂં” વગૈરા ન કહે બલ્કે સુન્નત ચેહ હૈ કે અપના નામ બતાએ.

ફરમાને મુસ્તફા ﷺ : صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : જો શાંસ મુઝ પર દુરૂદ પાક પઢના ભૂલ ગયા વોહ જન્મત કા રસ્તા ભૂલ ગયા. (مُرْسَل)

અચ્છે અન્દાઝ પર પુકાર કર સવાબ કમાઈયે

હોટોં સે “શિશી” કી આવાઝ નિકાલ કર કિસી કો બુલાના યા મુતવજજેહ કરના અચ્છા અન્દાઝ નહીં, નામ મા’લૂમ હોને કી સૂરત મેં “મદીના !” કહ કર ભી નહીં બલ્કે નામ યા કુન્યત સે પુકારે કે સુન્નત હૈ, ખુસૂસન ઈસ્તિન્જા ખાનોં ઓર ગન્દી જગહોં પર “મદીના” કહ કર પુકારને સે બચને કી સખ્ત ઝરૂરત હૈ. અગર નામ ન મા’લૂમ હો તો ઉસ મકામ કે ઉર્ફ કે મુતાબિક મુહઝઝબ અન્દાઝ મેં પુકારા જાએ, મ-સલન હમારે મુઆ-શરે મેં ઉમૂમન નૌ જવાન કો ભાઈજાન ! ભાઈ સાહિબ ! બડે ભાઈ ! ઓર ઉમ્ર રસીદા કો : ચયાજાન ! બુઝુર્ગોં ! વગૈરા કહ કર પુકારતે હૈં. બહર હાલ જબ ભી કિસી કો પુકારા જાએ તો મોમિન કા દિલ ખુશ કરને કે સવાબ કી નિચ્ચત કે સાથ અચ્છે મેં અચ્છા અન્દાઝ હો ઓર નામ ભી પૂરા લિયા જાએ નીઝ મૌકઅ કી મુના-સબત સે આખિર મેં લફઝ “ભાઈ” યા “સાહિબ” વગૈરા કા ભી ઈઝાફા હો, હજ કિયા હૈ તો “હાજી” કા લફઝ ભી શામિલ કર લિયા જાએ. જિસ કો પુકારા ગયા વોહ “લબ્બૈક” (યા’ની મેં હાઝિર હું) કહે. اَلْحَمْدُ لِلّٰهِ عَزَّوَجَلَّ દા’વતે ઈસ્લામી કે મ-દની માહોલ મેં અક્સર કિસી કી પુકાર પર જવાબન “લબ્બૈક” કહા જાતા હૈ જો કે સુનને મેં બહુત ભલા મા’લૂમ હોતા હૈ ઈસ સે મુસલ્માન કે દિલ મેં ખુશી દાખિલ હો સકતી હૈ. નીઝ સહાબએ કિરામ عَلَيْهِمُ الرِّضْوَانُ કા શહન્શાહે ખૈરુલ અનામ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ કે યાદ ફરમાને (યા’ની બુલાને) પર “લબ્બૈક” કે સાથ જવાબ દેના અહાદીસ મેં મઝકૂર હૈ, ઈસ કે ઈલાવા એક વલિય્યુલ્લાહ કે ફે’લ સે ભી ઈસ કા સુબૂત મિલતા હૈ. યુનાન્ચે કરોડોં હમ્બલિય્યોં કે અઝીમ પેશવા હઝરતે સચ્ચિદુના ઈમામ અહમદ

ફરમાને મુસ્તફા ﷺ : علی الله تعالى عليه وسلم : जिस के पास मेरा जिक्र हुआ और उस ने मुझ पर दुर्दे पाक न पड़ा तहकीक वीह
 બદબખ્ત હો ગયા. (૩૮)

બિન હમ્બલ رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ سے मस्जिदा पूछने के लिये उन्हें जब कोई
 अपनी तरफ मु-तवज्जह करता तो अक्सर “लम्बैक” इरमाते.

(مناقب الامام احمد بن حنبل للجوزي ص २११) मस्जिद हुआओं की मशहूर
 किताब “हिस्ने उसीन” में है : जब कोई शख्स तुझे बुलाये तो

जवाब में कहे : लम्बैक.

(حصن حصين ص १०६)

ખામોશી કી બ-ર-કત કી તીન મ-દની બહારે

﴿1﴾ ખામોશી કી બ-ર-કત સે દીદારે મુસ્તફા

એક ઈસ્લામી બહન કી તહરીર કા લુબ્બે લુબાબ હૈ : દા'વતે
 ઈસ્લામી કે ઈશાઅતી ઈદારે મક-ત-બતુલ મદીના કી તરફ સે જારી
 કર્દા ખામોશી કી અહમ્મિયત પર મબ્ની સુન્નતોં ભરે બયાન કે
 કેસિટ સુન કર મેં ને ઝબાન કે કુફલે મદીના કી તરકીબ શુરૂઅ કી
 યા'ની ખામોશી કી આદત ડાલને કા સિલ્સિલા ક્રિયા, તીન³ હી દિન
 મેં મુજે અન્દાઝા હો ગયા કે પહલે મેં કિસ કદર ફાલતૂ બાતેં ક્રિયા
 કરતી થી ! الْحَمْدُ لِلَّهِ عَزَّوَجَلَّ ! ખામોશી કી બ-ર-કત સે મુજે અચ્છે અચ્છે
 ખ્વાબ નઝર આને લગે, ફુઝૂલ ગોઈ સે બચને કી કોશિશ કે તીસરે દિન
 મેં ને મક-ત-બતુલ મદીના કી જારી કર્દા સુન્નતોં ભરે બયાન કી એક
 મઝીદ ઓડિયો કેસિટ બનામ “ઈતાઅત કિસે કહતે હેં” સુની. રાત
 જબ સોઈ તો الْحَمْدُ لِلَّهِ عَزَّوَجَلَّ કેસિટ મેં બયાન કર્દા એક વાકિઆ મુજે
 ખ્વાબ મેં દિખાઈ દેને લગા ! “જંગ કા નકશા થા, સરકારે મદીના
 صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ દુશ્મન કી જાસૂસી કે લિયે હઝરતે સચ્ચિદુના
 هُوَ الَّذِي رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ को रवाना करते हैं, वीह कुफ़्फ़ार के ખૈમોં કે
 पास પહોંચતે હેં તો ઉન્હેં કુફ્ફાર કે સરદાર હઝરતે અબૂ સુફ્યાન
 (જો અભી તક મુસલ્માન નહીં હુએ થે) ખડે હુએ નઝર આતે હેં,

કરમાને મુસ્તકા : حلى الله تعالى عليه وآله وسلم : जिस ने मुज पर दस मरतबा सुबह और दस मरतबा शाम दुइदे पाक पढा
(उसे क्रियामत के दिन मेरी शक्राअत मिलेगी. (कुरआन))

મૌકઅ ગનીમત જાનતે હુએ સચ્ચિદુના હુઝૈફા رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ
કમાન પર તીર ચઢા લેતે હેં કે ઉન્હેં સરકારે દો આલમ
صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ का हुकूम याद आता है (जिस का मइहूम है,
कोई छोउछाउ मत करना) युनान्ये अपने म-दनी अमीर की धताअत
करते हुअे तीर यलाने से बाउ रहते हें, फिर हाजिर हो कर
ताजदारे रिसालत صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ की ખિદમते બા બ-ર-કત
में कारकईगी पेश करते हें. اَلْحَمْدُ لِلَّهِ عَزَّوَجَلَّ मुजे ઇસ ખ્વાબ મેં સરકારે
મદીના رَضِيَ اللهُ تَعَالَى عَنْهَا और दौ सहाबअे किराम
की भूब वाउेह तौर पर जियारत नसीब हुई, बाकी सब मनाजिर
धुंदले नजर आ रहे थे.” मजीद लिखा है : اَلْحَمْدُ لِلَّهِ ! सिई तीन
दिन की कुजूल गोई से बयने की कोशिश से मुज पर आकाअे दौ
आलम صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ का बहुत बडा करम हो गया, बस
मेरी तमन्ना है के कबी ली मेरी जबान से कोई झालतू लइज न
निकले. आप हुआ कीजिये के मैं अपनी इस कोशिश में काम्याब
हो जाऊं.

પુસૂસન ઇસ્લામી બહનોં કો ઇસ ખુશ નસીબ ઇસ્લામી બહન
પર કાફી રશક આ રહા હોગા. કિસી ઇસ્લામી બહન કા ખામોશી
ઇખ્તિયાર કરના વાકેઈ બહુત બડી બાત હૈ ક્યૂંકે મદોં કે મુકાબલે મેં
ઉમૂમન ઔરતેં જિયાદા બોલતી હેં.

अव्वाह जबां का हो अता कुइले मदीना

में काश ! जबां पर लूं लगा कुइले मदीना

(વસાઇલે બખ્શિશ, સ. 66)

صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلَّى اللهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

કરમાને મુસ્તકા علی اللہ تعالیٰ علیه و آله وسلم : जिस के पास मेरा जिक्र हुआ और उस ने मुझ पर दुःख शरीफ़ न पड़ा उस ने जका की. (मैराज)

❷) અલાકે મેં મ-દની માહોલ બનાને મેં ખામોશી કા કિરદાર

એક ઈસ્લામી ભાઈ ને સગે મદીના عنة કો જો મક્તૂબ ભેજા ઉસ કા લુબ્બે લુબાબ હૈ કે “દા’વતે ઈસ્લામી” કે સુન્નતોં ભરે ઈજતિમાઅ મેં ખામોશી કે મુ-તઅલ્લિક સુન્નતોં ભરા બયાન સુનને સે પહલે મ-દની માહોલ સે વાબસ્તા હોને કે બા વુજૂદ મેં બહુત ફુઝૂલ ગો થા, દુરૂદ શરીફ કી કોઈ ખાસ કસરત ન થી. જબ સે યુપ રહને કી કોશિશ શુરૂઅ કી હૈ, રોઝાના એક હઝાર દુરૂદ શરીફ પઢના નસીબ હો રહા હૈ. વરના મેરા અનમોલ વક્ત ઈધર ઉધર કી ફુઝૂલ બહસોં મેં બરબાદ હો જાતા થા. બારહ દિન મેં પઢે હુએ 12 હઝાર દુરૂદ શરીફ કા સવાબ આપ કો તોહફતન પેશ (યા’ની ઈસાલે સવાબ) કરતા હૂં. મઝીદ અર્ઝ હૈ કે મેરે બાતૂની મિઝાજ કે બાઈસ હોને વાલી કજ બહસી (યા’ની ઉલટી સીધી બાતોં) કી નુહૂસત સે હમારે ઝૈલી હલકે મેં દા’વતે ઈસ્લામી કે મ-દની કામ કો ભી નુક્સાન પહોંચ જાતા થા. પિછલે દિનોં હમારે હલકે મેં આપસ કા ઈખ્તિલાફ નિમટાને કે લિયે મ-દની મશ્વરા હુવા, હૈરત બાલાએ હૈરત કે મેરી ખામોશી કે સબબ سبب સારા ઝગડા બ આસાની ખત્મ હો ગયા. હમારે “નિગરાને પાક” ને ખુશી કા ઈઝહાર કરતે હુએ મુઝ સે બે તક્લ્લુફી મેં કુછ ઈસ તરહ ફરમાયા : “મુઝે બહુત ડર લગ રહા થા કે શાયદ આપ બહસ શુરૂઅ કરેંગે ઔર બાત કા બતંગડ બન જાએગા લેકિન આપ કે ખામોશી અપનાને કી ને’મત ને હમેં રાહત બખ્શી.” દર અસ્લ બાત યેહ હૈ કે ઈસ સે કબ્લ મુઝ ના લાઈક કી ફુઝૂલ બહસ ઔર બક બક કી આદતે બદ કે સબબ “મ-દની મશ્વરે” વગૈરા કા માહોલ ખરાબ હો જાયા કરતા થા.

કરમાને મુસ્તફા صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّمَ : જો મુઝ પર રોઝે જુમુઆ દુરુદ શરીફ પઢેગા મેં કિયામત કે દિન ઉસ કી શકાઅત કરુંગા. (ક્રમલ)

મ-દની કામોં કે લિયે મ-દની હથિયાર

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો! દેખા આપ ને? ફુઝૂલ બાતોં સે બચના મ-દની કામોં કે લિયે કિસ કદર મુફીદ હૈ. લિહાઝા જો સુન્નતોં કા મુબલ્લિગ હૈ ઉસે તો હર હાલ મેં સન્જીદા ઔર કમ ગો હોના ચાહિયે. જો બડ-બડિયા, બાતૂની, દૂસરોં કી બાત કાટને વાલા, બાર બાર બીચ મેં બોલ પડને વાલા, બાત બાત પર બહસ વ તકરાર કરને ઔર “બાલ કી ખાલ” ઉતારને વાલા હો ઉસ કી વજહ સે દીન કે કામ કો નુક્સાન પહોંચને કા સપ્ત અન્દેશા રહતા હૈ, ક્યૂંકે ખામોશી જો કે શૈતાન કો માર ભગાને કા “મ-દની હથિયાર” હૈ ઈસ સે યેહ બદ નસીબ મહરૂમ હૈ. હઝરતે સચ્ચિદુના અબૂ ઝર ગિફારી رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ કો વસિયત કરતે હુએ તાજદારે રિસાલત, મુસ્તફા જાને રહમત صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ને ફરમાયા : “ખામોશી કી કસરત કો લાઝિમ કર લો કે ઈસ સે શૈતાન દફૂઅ હોગા ઔર તુમ્હેં દીન કે કામોં મેં મદદ મિલેગી.”

(شُعْبُ الْإِيمَان ج ٤ ص ٢٤١ حدیث ٤٩٤٢)

અલ્લાહ ઈસ સે પહલે ઈમાં પે મૌત દે દે

નુક્સાં મેરે સબબ સે હો સુન્નતે નબી કા

(વસાઈલે બખ્શિશ, સ. 108)

صَلُّوْا عَلَی الْحَبِیْب! صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّمَ

③ ઘર મેં મ-દની માહોલ બનાને મેં ખામોશી કા કિરદાર

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો! બે ઝરૂરત બાત, હંસી મઝાક, ઔર તૂતડાક કી આદાત નિકાલ દેને સે ઘર મેં ભી આપ કા વકાર બુલન્દ હોગા ઔર જબ ઘર કે અફરાદ આપ કે સન્જીદા પન સે મુ-તઅસ્સિર હોંગે તો ઉન પર આપ કી “નેકી કી દા’વત” બહુત જલ્દ અસર કરેગી ઔર ઘર

કરમાને મુસ્તકા : صَلَّى اللهُ عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : મુઝ પર દુરુદે પાક કી કસરત કરો બેશક યેહ તુમ્હારે લિયે તહારત હૈ. (જુમ્હુર)

મેં મ-દની માહોલ ન હુવા તો બનાને મેં આસાની હો જાએગી. યુનાન્યે “દા’વતે ઈસ્લામી” કે સુન્નતોં ભરે ઈજતિમાઅ મેં ખામોશી કી અહમ્મિયત પર ક્રિયા હુવા એક સુન્નતોં ભરા બયાન સુન કર એક ઈસ્લામી ભાઈ ને જો તહરીર દી ઉસ કા ખુલાસા હૈ : સુન્નતોં ભરે બયાન મેં દી ગઈ હિદાયત કે મુતાબિક **اَلْحَمْدُ لِلّٰهِ عَزَّوَجَلَّ** મુઝ બાતૂની આદમી ને ખામોશી કી આદત ડાલની શુરૂઅ કર દી હૈ, **سُبْحَانَ اللهِ !** ઈસ કા મુઝે બેહદ ફાએદા પહોંચ રહા હૈ, મેરે અબુલ ફુઝૂલ હોને કી વજહ સે ઘર કે અફરાદ મુઝ સે બદઝન થે મગર જબ સે યુપ રહના શુરૂઅ ક્રિયા હૈ, ઘર મેં મેરી “પોઝીશન” બન ગઈ હૈ ઓર ખુસૂસન મેરી પ્યારી પ્યારી માં જો કે મુઝ સે ખૂબ બેઝાર રહા કરતી થીં અબ બેહદ ખુશ હો ગઈ હૈં, ચૂંકે પહલે મેં બહુત “બક્કી” થા લિહાઝા મેરી અચ્છી બાતેં ભી બે અસર હો જાતી થીં મગર અબ મેં અમ્મીજાન કો જબ કોઈ સુન્નત વગૈરા બતાતા હૂંતો વોહ ન સિફ દિલવચ્સપી સે સુનતી હૈં બલકે અમલ કરને કી ભી કોશિશ કરતી હૈં.

બઢતા હૈ ખમોશી સે વકાર ઐ મેરે પ્યારે

ઐ ભાઈ ! ઝબાં પર તૂ લગા કુફલે મદીના

(વસાઈલે બખ્શિશ, સ. 66)

صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلَّى اللهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

“યા રબ્બે કરીમ ! હમેં મુતકી બના” કે ઉન્નીસ

હુરૂફ કી નિસ્બત સે ઘર મેં “મ-દની માહોલ”

બનાને કે 19 મ-દની ફૂલ

﴿1﴾ ઘર મેં આતે જાતે બુલન્દ આવાઝ સે સલામ કીજિયે.

﴿2﴾ વાલિદા યા વાલિદ સાહિબ કો આતે દેખ કર તા’ઝીમન ખડે હો જાઈયે.

કરમાને મુસ્તફા વ્હાલે વ્હાલે વ્હાલે : તુમ જહાં ભી હો મુઝ પર દુરુદ પઢો કે તુમ્હારા દુરુદ મુઝ તક પહોંચતા હૈ. (પ્રા. ૧)

❸ દિન મેં કમ અઝ કમ એક બાર ઈસ્લામી ભાઈ વાલિદ સાહિબ કે ઓર ઈસ્લામી બહનેં માં કે હાથ ઓર પાઉં ચૂમા કરેં.

❹ વાલિદૈન કે સામને આવાઝ ધીમી રખિયે, ઈન સે આંખેં હરગિઝ ન મિલાઈયે, નીચી નિગાહેં રખ કર હી બાતચીત કીજિયે.

❺ ઉન કા સૌંપા હુવા હર વોહ કામ જો ખિલાફે શર-અ ન હો ફૌરન કર ડાલિયે.

❻ સન્જ-દગી અપનાઈયે. ઘર મેં તૂ તુકાર, અબે તબે ઓર મઝાક મસ્ખરી કરને, બાત બાત, પર ગુસ્સે હો જાને, ખાને મેં ઐબ નિકાલને, છોટે ભાઈ બહનોં કો ઝાડને, મારને ઘર કે બડોં સે ઉલઝને, બહસેં કરતે રહને કી અગર આપ કી આદતેં હોં તો અપના રવયા યક્સર તબ્દીલ કર દીજિયે, હર એક સે મુઆફી તલાફી કર લીજિયે.

❼ ઘર મેં ઓર બાહર હર જગહ આપ સન્જદા હો જાએંગે તો ઘર કે અન્દર ભી ઝરૂર ઈસ કી બ-ર-કતેં ઝાહિર હોંગી.

❽ માં બહે બચ્ચોં કી અમ્મી હો તો ઉસે નીઝ ઘર (ઓર બાહર) કે એક દિન કે બચ્ચે કો ભી “આપ” કહ કર હી મુખાતિબ હોં.

❾ અપને મહલ્લે કી મસ્જિદ મેં ઈશા કી જમાઅત કે વક્ત સે લે કર દોઢ ઘન્ટે કે અન્દર અન્દર સો જાઈયે. કાશ ! તહજજુદ મેં આંખ ખુલ જાએ વરના કમ અઝ કમ નમાઝે ફજૂર તો બ આસાની (મસ્જિદ કી પહલી સફ મેં બા જમાઅત) મુયસ્સર આએ ઓર ફિર કામકાજ મેં ભી સુસ્તી ન હો.

❿ ઘર કે અફરાદ મેં અગર નમાઝોં કી સુસ્તી, બે પર્દગી, ફિલ્મોં ડિરામોં ઓર ગાને બાજોં કા સિલ્સિલા હો ઓર આપ અગર સર પરસ્ત નહીં હોં, નીઝ ઝન્ને ગાલિબ હૈ કે આપ કી નહીં સુની જાએગી

ફરમાને મુસ્તફા : صَلَّى اللهُ عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : जिस के पास मेरा जिक्र हो और वोह मुझ पर दुइइ शरीफ़ न पढे तो वोह लोगों में से क्यूँस तरीन शफ्स है. (त्रिभुज)

તો બાર બાર ટોકા ટોકા કે બજાએ, સબ કો નરમી કે સાથ મક-ત-બતુલ મદીના સે જારી શુદા સુન્નતોં ભરે બયાનાત કી ઓડિયો કેસિટે, ઓડિયો/ વિડિયો સીડીઝ સુનાઈયે દિખાઈયે, મ-દની ચેનલ દિખાઈયે.

إِنَّ شَاءَ اللهُ عَزَّوَجَلَّ “મ-દની નતાઈજ” બરઆમદ હોંગે.

﴿11﴾ ઘર મેં કિતની હી ડાંટ બલકે માર ભી પડે, સબ્ર સબ્ર ઓર સબ્ર કીજિયે. અગર આપ ઝબાન ચલાએંગે તો “મ-દની માહોલ” બનને કી કોઈ ઉમ્મીદ નહીં બલકે મઝીદ બિગાડ પૈદા હો સકતા હૈ કે બે જા સપ્તી કરને સે બસા અવકાત શૈતાન લોગોં કો ઝિદી બના દેતા હૈ.

﴿12﴾ મ-દની માહોલ બનાને કા એક બેહતરીન ઝરીઆ યેહ ભી હૈ કે ઘર મેં રોઝાના ફૈઝાને સુન્નત કા દર્સ ઝરૂર ઝરૂર ઝરૂર દીજિયે યા સુનિયે.

﴿13﴾ અપને ઘર વાલોં કી દુન્યા વ આખિરત કી બેહતરી કે લિયે દિલસોઝી કે સાથ દુઆ ભી કરતે રહિયે કે ફરમાને મુસ્તફા : صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : هَيْ الدُّعَاءُ سِلَاحُ الْمُؤْمِنِ : હૈ યા'ની દુઆ મોમિન કા હથિયાર હૈ.

(الْمُسْتَدْرَكُ لِلْحَاكِمِ ج ٢ ص ١٦٢ حَدِيث ١٨٥٥)

﴿14﴾ સુસરાલ મેં રહને વાલિયાં જહાં ઘર કા ઝિક્ર હૈ વહાં સુસરાલ ઓર જહાં વાલિદૈન કા ઝિક્ર હૈ વહાં સાસ ઓર સુસર કે સાથ વોહી હુસ્ને સુલૂક બજા લાએ જબકે કોઈ માનેએ શર-ઈ ન હો. હાં યેહ એહતિયાત ઝરૂરી હૈ કે બહૂ સુસર કે હાથ પાઉં ન ચૂમે, યૂંહી દામાદ સાસ કે.

﴿15﴾ મસાઈલુલ કુરઆન સફહા 290 પર હૈ : હર નમાઝ કે બા'દ યેહ દુઆ અવ્વલ વ આખિર દુરૂદ શરીફ કે સાથ એક બાર પઢ લીજિયે, إِنَّ شَاءَ اللهُ عَزَّوَجَلَّ બાલ બચ્ચે સુન્નતોં કે પાબન્દ બનેંગે ઓર ઘર મેં

ફરમાને મુસ્તફા علی اللہ تعالیٰ علیه و آله وسلم : उस शपथ की नाक भाक आवृद्ध हो जिस के पास मेरा ठिक हो और वोह मुज पर दुरुद्वे पाक न पड़े. (१७)

મ-દની માહોલ કાઈમ હોગા. (દુઆ યેહ હૈ :) (اللَّهُمَّ)

رَبَّنَا هَبْ لَنَا مِنْ أَزْوَاجِنَا ذُرِّيَّتًا قَرَّةً أَعْيُنٍ وَاجْعَلْنَا لِلْمُتَّقِينَ إِمَامًا ﴿١٦﴾

(“اللَّهُمَّ” આયતે કુરઆની કા હિસ્સા નહીં)

﴿16﴾ ના ફરમાન બચ્યા યા બડા જબ સોયા હો તો 11 યા 21 દિન તક ઉસ કે સિરહાને ખડે હો કર યેહ આયાતે મુબા-રકા સિર્ફ એક બાર ઈતની આવાજ સે પઢિયે કે ઉસ કી આંખ ન ખુલે :

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ ۞ بَلْ هُوَ قُرْآنٌ مَّجِيدٌ ﴿١٦﴾ فِي لَوْحٍ مَّحْفُوظٍ ۞ ع 2

(અવ્વલ, આખિર, એક મર્તબા દુરુદ શરીફ) યાદ રહે ! બડા ના ફરમાન હો તો સોતે સોતે સિરહાને વઝીફા પઢને મેં ઉસ કે જાગને કા અન્દેશા હૈ ખુસૂસન જબ કે ઉસ કી નીંદ ગહરી ન હો, યેહ પતા ચલના મુશ્કિલ હૈ કે સિર્ફ આંખેં બન્દ હૈં યા સો રહા હૈ લિહાજા જહાં ફિતને કા ખૌફ હો વહાં યેહ અમલ ન ક્રિયા જાએ ખાસ કર બીવી અપને શોહર પર યેહ અમલ ન કરે.

﴿17﴾ નીજ ના ફરમાન ઔલાદ કો ફરમાં બરદાર બનાને કે લિયે તા હુસૂલે મુરાદ નમાઝે ફજૂર કે બા'દ આસ્માન કી તરફ રુખ કર કે “يَا شَهِيدُ” 21 બાર પઢિયે. (અવ્વલ વ આખિર, એક બાર દુરુદ શરીફ).

﴿18﴾ મ-દની ઈન્આમાત કે મુતાબિક અમલ કી આદત બનાઈયે ઔર ઘર કે જિન અફરાદ કે અન્દર નર્મ ગોશા પાઁ ઉન મેં ઔર આપ અગર

1 : તર-જ-મએ કન્જુલ ઈમાન : એ હમારે રબ હમેં દે હમારી બીબિયોં ઔર હમારી ઔલાદ સે આંખોં કી ઠન્ક ઔર હમેં પરહેજ ગારોં કા પેશવા બના. (૧૧૧. الفرقان)

2 : તર-જ-મએ કન્જુલ ઈમાન : બલ્કે વોહ કમાલ શરફ વાલા કુરઆન હૈ લૌહે મહફૂઝ મેં. (૩૦. البروج: ૨૧-૨૨)

ફરમાને મુસ્તફા ﷺ : طَى اللّٰهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : जिस ने मुज पर रोजे जुमुआ दो सो बार दुइटे पाक पढा उस के दो सो साल के गुनाह मुआफ़ होंगे. (क़िमान)

બાપ હેં તો ઔલાદ મેં નરમી ઔર હિક્મતે અ-મલી કે સાથ મ-દની ઈન્આમાત કા નિફાઝ કીજિયે, અલ્લાહ عَزَّ وَجَلَّ કી રહમત સે ઘર મેં મ-દની ઈન્કિલાબ બરપા હો જાએગા.

﴿19﴾ પાબન્દી સે હર માહ કમ અઝ કમ તીન દિન કે મ-દની કાફિલે મેં આશિકાને રસૂલ કે સાથ સુન્નતોં ભરા સફર કર કે ઘર વાલોં કે લિયે ભી દુઆ કીજિયે. મ-દની કાફિલે મેં સફર કી બ-ર-કત સે ભી ઘરોં મેં મ-દની માહોલ બનને કી “મ-દની બહારેં” સુનને કો મિલતી હેં.

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! બયાન કો ઈખ્તિતામ કી તરફ લાતે હુએ સુન્નત કી ફઝીલત ઔર ચન્દ સુન્નતેં ઔર આદાબ બયાન કરને કી સઆદત હાસિલ કરતા હૂં. તાજદારે રિસાલત, શહન્શાહે નુબુવ્વત, મુસ્તફા જાને રહમત, શમ્એ બઝમે હિદાયત, નૌશએ બઝમે જન્નત صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ કા ફરમાને જન્નત નિશાન હે : जिस ने मेरी सुन्नत से महब्बत की उस ने मुज से महब्बत की और जिस ने मुज से महब्बत की वोह जन्मत में मेरे साथ होगा. (ابن عساکر ج ۹ ص ۳۴۳)

સીના તેરી સુન્નત કા મદીના બને આકા

જન્નત મેં પડોસી મુઝે તુમ અપના બનાના

صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلَّى اللهُ تَعَالَى عَلَى مُحَمَّد

“મિસ્વાક કરના સુન્નતે મુબારકા હૈ” કે બીસ હુરફ કી નિસ્બત સે મિસ્વાક કે 20 મ-દની ફૂલ

પહલે દો ફરામીને મુસ્તફા صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ મુલા-હઝા હોં :

❁ દો રકઅત મિસ્વાક કર કે પઢના બિગૈર મિસ્વાક કી 70 રકઅતોં સે અફઝલ હૈ (حدیث ۱۰۲ ص ۱۰۲) ❁ મિસ્વાક કા ઈસ્તિ'માલ અપને

करमाने मुस्तका على الله تعالى عليه وآله وسلم : मुज पर कसरत से दुरुदे पाक पढे बेशक तुम्हारा मुज पर दुरुदे पाक पढना तुम्हारे गुनाहों के लिये मग़्फ़िरत है. (276)


हकीकत तो (मेरे नजदीक) मख़्दर के पर बराबर ली नहीं थी, तो आभिर औसी हकीर दौलत इस अजीम सुन्नत (मिस्वाक) को हासिल करने पर क्यूं जर्य नहीं की ?” (مُلَخَّصٌ از لَوَاقِحِ الْاِنْوَارِ ص 28) ❀ सय्यिदुना ईमाम शाफ़ैई عَلَيْهِ رَحْمَةُ اللهِ الْقَوِي ईरमाते हैं : यार⁴ यीं अकल बढाती हैं : हुजूल बातों से परहेज, मिस्वाक का ईस्ति'माल, सु-लहा या'नी नेक लोगों की सोहबत और अपने ईल्म पर अमल करना (حياة العلوم ج 3 ص 27) ❀ मिस्वाक पीलू या जैतून या नीम वगैरा कडवी लकड़ी की हो ❀ मिस्वाक की मोटाई छुंग्लिया या'नी छोटी उंगली के बराबर हो ❀ मिस्वाक अक बालिशत से ज़ियादा लम्बी न हो वरना उस पर शैतान बैठता है ❀ इस के रेशे नर्म हों के सप्त रेशे दांतों और मसूढ़ों के दरमियान खला (GAP) का भाईस बनते हैं ❀ मिस्वाक ताजा हो तो पूब (या'नी बेहतर) वरना कुछ देर पानी के गिलास में त्रिगो कर नर्म कर लीजिये ❀ मुनासिब है के इस के रेशे रोजाना काटते रहिये के रेशे उस वक्त तक कारआमद रहते हैं जब तक उन में तल्पी बाकी रहे ❀ दांतों की यौडाई में मिस्वाक कीजिये ❀ जब ली मिस्वाक करनी हो कम अज कम तीन बार कीजिये ❀ हर बार धो लीजिये ❀ मिस्वाक सीधे हाथ में इस तरह लीजिये के छुंग्लिया या'नी छोटी उंगली उस के नीचे और बीच की तीन उंग्लियां ठीपर और अंगूठा सिरे पर हो ❀ पहले सीधी तरफ़ के ठीपर के दांतों पर फिर उलटी तरफ़ के ठीपर के दांतों पर फिर सीधी तरफ़ नीचे फिर उलटी तरफ़ नीचे मिस्वाक कीजिये ❀ मुट्टी बांध कर मिस्वाक करने से बवासीर हो जाने का अन्देशा है ❀ मिस्वाक पुजू की सुन्नते कब्ब्लिया है अलबत्ता सुन्नते मुअक्कदा उसी वक्त है जबके मुंह में बढबू हो (मापूज अज इतावा र-जविय्या, जि. 1, स. 623)

ફરમાને મુસ્તફા ﷺ : जो मुज पर एक दुवद शरीर पढता है अल्लाह उस के लिये एक कीरात अजर लिफता है और कीरात उहुद पहाड जितना है. (Jizrah)

❁ મિસ્વાક જબ ના કાબિલે ઈસ્તિ'માલ હો જાએ તો ફેંક મત દીજિયે કે યેહ આલએ અદાએ સુન્નત હૈ, કિસી જગહ એહતિયાત સે રખ દીજિયે યા દફન કર દીજિયે યા પથ્થર વગૈરા વઝન બાંધ કર સમુન્દર મેં ડબો દીજિયે. (તફ્સીલી મા'લૂમાત કે લિયે મક-ત-બતુલ મદીના કી મત્બૂઆ બહારે શરીઅત જિહ્દ અવ્વલ સફહા 294 તા 295 કા મુતા-લઆ ફરમા લીજિયે)

હઝારોં સુન્નતોં સીખને કે લિયે મક-ત-બતુલ મદીના કી મત્બૂઆ દો કુતુબ (1) 312 સફહાત પર મુશ્તમિલ કિતાબ બહારે શરીઅત હિસ્સા 16 ઓર (2) 120 સફહાત કી કિતાબ “સુન્નતોં ઓર આદાબ” હદિથ્યતન હાસિલ કીજિયે ઓર પઢિયે. સુન્નતોં કી તરબિથ્યત કા એક બેહતરીન ઝરીઆ દા'વતે ઈસ્લામી કે મ-દની કાફિલોં મેં આશિકાને રસૂલ કે સાથ સુન્નતોં ભરા સફર ભી હૈ.

લૂટને રહમતેં કાફિલે મેં યલો સીખને સુન્નતેં કાફિલે મેં યલો હોંગી હલ મુશ્કિલેં કાફિલે મેં યલો
 صَلَّى اللهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ



એક યુપ સો સુખ

યેહ રિસાલા પઠ કર દૂસરે કો દે દીજિયે

શાદી ગમી કી તકરીબાત, ઈજતિમાઆત, આ'રાસ ઓર જુલૂસે મીલાદ વગૈરા મેં મક-ત-બતુલ મદીના કે શાએઅ કદા' રસાઈલ ઓર મ-દની ફૂલોં પર મુશ્તમિલ પેફ્લેટ તક્સીમ કર કે સવાબ કમાઈયે, ગાહકોં કો બ નિચ્યતે સવાબ તોહફે મેં દેને કે લિયે અપની દુકાનોં પર ભી રસાઈલ રખને કા મા'મૂલ બનાઈયે, અખ્બાર ફરોશોં યા બચ્ચોં કે ઝરીએ અપને મહલ્લે કે ઘર ઘર મેં માહાના કમ અઝ કમ એક અદદ સુન્નતોં ભરા રિસાલા યા મ-દની ફૂલોં કા પેફ્લેટ પહોંચા કર નેકી કી દા'વત કી ધૂમેં મચાઈયે ઓર ખૂબ સવાબ કમાઈયે.

ईसरिस

उन्वान	सङ्ख्या	उन्वान	सङ्ख्या
दुर्द शरीक की इजीवत	1	कुने की शकल वावा	16
भामोशी में अन्न है	2	जन्त हाराम है	17
बहराम और परन्दा	3	सात म-दनी इवों का "फ़ाड़की गुलदस्ता"	17
भामोशी की इजीवत पर यार फ़रामीने मुस्तफ़ा	3	औं काश ! अँसा हो ज़अे.....	18
60 साल की ठंभादत से बेहतरी की वज़ाहत	3	अेक सलाभी के जन्ती होने का राज	18
फ़ालतू भातों के यार लरज़ा भैज़ नुक्सानात	4	इज़ूव भातों की मिसालें	19
सभ से ज़ियादा नुक्सान देह यीज़	6	इज़ूव गो का जूटे मुभा-लगे के गुनाह	
भवाठ की भात करो या युप रछो	6	से बनना दृशवार होता है	21
अगर जन्त दरकार हो तो.....	7	काश ! भोलने से कबल जरा ठहर कर	
भामोशी ठमान की सलामती का ज़रीआ है	7	तोलने की सआदत मिल ज़अे	21
भामोशी ज़ाहिल का पर्दा है	8	दृशत गर्दियों के इज़ूव तज़क़िरे	22
भामोशी ठंभादत की याभी है	8	सिद्दीके अकबर मुंछ में पथर रभ लेते	23
माव की खिफ़ाज़त आसान है मगर ज़बान.....	8	40 बरस तक भामोशी की मशक	23
भोलने वावा बारहा पछताता है	9	गुफ़्त-गू विभ कर मुहा-सभा करने	
"भोल कर" पछताने से "न भोल कर"		वाले ताबेठि भुजुर्ग	24
पछताना अख़्त	9	भातयीत के मुहा-सभे का तरीका	24
गूंगा फ़ाअेदे में रहता है	10	उमर बिन अब्दुल अज़ीज़ कूट कूट कर रोअे	25
घर अन्न का गडवारा कैसे बने !	10	ख़िकायत की वज़ाहत	26
सास बहू का जग़ा निमताने का म-दनी नुस्मा	11	भात को इज़ूविय्यात से पाक करने का	
ज़बान की बिदमत में दर-भ्वास्त	12	बेहतरीन नुस्मा	27
अख़्त भात करने की इजीवत	13	भे वुकूफ़ भे सोये भोलता है	29
आका तवील भामोशी वाले थे	13	भोलने से पहले तोलने का तरीका	29
भोलने और युप रहने की दो डिस्में	14	युप रहने का तरीका	31
फ़ोइश भात की ता'रीक़	15	अख़्त अन्दाज़ पर पुकार कर सवाभ कमाँये	33
मुंछ से भून और पीप बह रखा होगा	16	भामोशी की भ-र-कत की तीन म-दनी बहारें	34

قرمانه مؤسآا طى الله تعالى عليه وآله وسلم : ؤس نے آناآه مں مؤآ پر ءوآهه پاک لآناآا آو ؤآه آك مہرا ناآه ؤس مں رآهگا ؤرآشآه ؤس كے لآهه ؤسآآكار كرسآه رآهههه (طه)

﴿1﴾ آاموशी كى آ-ر-كآ سه ءآءاره مؤسآا	34	﴿3﴾ آر مں م-ءنى ماآول بانانه	
﴿2﴾ آلاكه مں م-ءنى ماآول بانانه مں آاموशी		مں آاموशी كا كآرءار	37
كا كآرءار	36	آر مں "م-ءنى ماآول" بانانه كے 19 م-ءنى ؤل	38
م-ءنى كاآوں كے لآهه م-ءنى لآهآار	37	مآسواك كے 20 م-ءنى ؤل	42

مآآء ومراجع

مطبوعه	كآب	مطبوعه	كآب
ضآاء القرآن ؤلى كآشز مرآز الاآلاء لاهور	مراجعاآآ	مكآبه المءآه باب المءآه كراچى	قرآن پاك
ءاراكآب العلمآه بهرآه	آآاف الساءه	مكآبه المءآه باب المءآه كراچى	آرآه كآز الاآمان
ءار صاءو بهرآه	آآاء العلوم	ءاراكآب العلمآه بهرآه	صآآ آآارى
ءار الفكر بهرآه	مسآرف	ءار الفكر بهرآه	سآن آرآى
مؤسسه الرآان بهرآه	القول المءآ	ءار الفكر بهرآه	مسآامام آآه
ءاراكآب العربى بهرآه	آآبآه الفالآن	ءاراكآب العلمآه بهرآه	اسآن الكبرى
ءاراكآب العلمآه بهرآه	مآهآ العابءآن	ءار المعرفه بهرآه	المسآر ك
ءاراكآب العلمآه بهرآه	آارآ آآءاء	ءاراكآب العلمآه بهرآه	شآب الاآمان
ءار الفكر بهرآه	آارآ آآق	ءاراكآب العلمآه بهرآه	الفروآ مآآور آآآاب
آواسه وقت پآرآ مرآز الاآلاء لاهور	كشف المسآوب	ءاراكآب العلمآه بهرآه	آآع الجوامع
پشاور	المسآاء	المكآبه آآصرآه بهرآه	آصآ مع مؤسسه ان ابى الءآنا
ءار آآاء آآرآ العربى بهرآه	آورآ الاآوار	ءاراكآب العلمآه بهرآه	شآر السآه
رضاقا ءظآن آس مرآز الاآلاء لاهور	آلاى رضوبه	المكآبه آآصرآه بهرآه	آصن آصآن
مكآبه المءآه باب المءآه كراچى	بهار شرعآه	ءار اآن آآرون بهرآه	مآآب آآمآن آآن
مكآبه المءآه باب المءآه كراچى	وسائل آآشش	ءار الفكر بهرآه	مرقاا المآآآ